



Draft Social Impact Assessment Report

Acquisition of Land For Work Development and Beautification Around Nani Daman Fort



Submitted to:

The District Collector, Daman

Prepared by:

SR Asia,
4-CS-25, Ansal Plaza, Vaishali, Sector-1,
Ghaziabad-201010, Uttar Pradesh



ACKNOWLEDGEMENT

This social impact assessment (SIA) report for the land acquisition for Work Development and Beautification Around Nani Daman Fort is a result of the work executed by SR Asia as per the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013. The SIA team had extensive consultation with the officials of Department of Revenue and Land Reforms, public representatives and project affected families (PAFs) of Daman Municipal Council, Daman for collecting valuable inputs, data on local ecology, culture and socio-economic profiles.

We extend our sincere thanks to all the officials of Daman Collectorate for their continuous support and cooperation.

We are also grateful to all the respondents of SIA study including project affected families (PAFs) and local representatives for their time and feedback. We appreciate the efforts made by all the participants of this study and thank them for their support.

Birendra Raturi
(International Director)
SR Asia

ABBREVIATIONS

CPR	Common Property Resources
D&D	Daman and Diu
DNH	Dadra and Nagar Haveli
DPR	Detailed Project Report
FGD	Focused Group Discussion
LA	Land Acquisition
LAP	Land Acquisition Plan
NA	Not Applicable
PAFs	Project Affected Families
PAPs	Project Affected Population
R&R	Rehabilitation and Resettlement
RFCTLARR 2013	Right to Fair Compensation and Transparency in Land Acquisition Resettlement and Rehabilitation Act, 2013
SIA	Social Impact Assessment
SIMP	Social Impact Management Plan
U.T.	Union Territory

TABLE OF CONTENT

ACKNOWLEDGEMENT	1
ABBREVIATIONS	2
EXECUTIVE SUMMARY	5
1. DETAILED PROJECT DESCRIPTION	7
1.1 About the Project	7
1.2 Project Background	7
1.3 Necessity and purpose of the Project	7
1.4 Project Location	8
1.5 Project cost	9
1.6 Project Alternative	9
2. TEAM COMPOSITION, APPROACH AND METHODOLOGY	10
2.1 Objectives and Scope of study	10
2.2 Team Composition	11
2.3 Approach and Methodology	11
2.3.1 Methods and Tools of Study	12
2.3.2 Desk Review	12
2.3.3 Site Visit	12
2.3.4 Questionnaire Survey and FGDs	13
2.3.5 Stakeholders' Consultation	13
2.4 Public Hearing	13
2.5 Schedule of SIA Study	14
2.6 Monitoring and Quality Assurance	15
3. LAND ASSESSMENT	16
3.1 Land Required for the Project	16
3.2 Type of Land and Soil	16
3.3 Land Use Pattern	16
3.4 Land Assessment Details	16
3.5 Ownership of Land and Extent of Impact	17
3.6 Land area and Land Holders	17
4. ESTIMATION AND ENUMERATION OF FAMILY ASSETS	18
4.1 Number of Residence and Affected Structures	18
4.2 Loss of Common Property	18
4.3 Loss of Individual Assets	19

5. SOCIO-ECONOMIC AND CULTURAL PROFILE	21
5.1 Demographic Profile	21
5.2 Socio-economic Profile	22
5.3 Stakeholders Consultation	27
6. PUBLIC CONSULTATION	28
7. SOCIAL IMPACT AND SOCIAL IMPACT MANAGEMENT PLAN	29
7.1 Approach to Mitigation`	29
7.2 Social Impact	29
7.5 Social Impact Management Plan	32
7.6 Measures to Avoid, Mitigate and Compensate	33
8. COST AND BENEFIT ANALYSIS	34
8.1 Assessment of Public Purpose	34
8.2 Impact on Structures and Its Magnitude	34
8.3 Determinants of Compensation	34
8.4 Entitlement Matrix	34
8.5 Criteria for Compensation based on Quality of Soil/Land	36
8.6 Cost Estimation of Land	36
8.7 Conditions and Recommendations for Acquisition of Land	37
8.8 Compensation Amount Awarded to the Land Owners Based on Government Approved Rate of Land	37
9. PUBLIC HEARING	38
10. RECOMMENDATIONS	39
PHOTO GALLERY	40
REFERENCES	44
ANNEXURES	45

EXECUTIVE SUMMARY

The Department of Tourism, Daman is carrying out the project for development work and beautification around Nani Daman Fort. The U.T. Administration of Daman and Diu had decided to acquire 1151 Sq metre of land adjacent to the Fort in Daman Municipal Council area. The identified location is situated in proximity to the boundary wall of the fort and at the back side of the fort. The proposed land to be acquired is residential in nature with land use pattern NA. It consists of building structures, house walls and around 10 fruit bearing trees such as coconut, mango trees and around 40 plants of flower and other non-fruit bearing trees.

The total land required is 1151 Sq metre as per notification No. 3/118/LND-ACQ/2023-24/3748 dated 10/10/2023 under section 4 Rule 3 and is owned by seven PAPs. The ownership of land is through heredity. Project Affected Family (PAF) uses the land majorly for residential purposes. More details are as below:

Table 1.1: Details of land and attributes

Number of PAFs for surveys	3
Size of the land to be acquired	1151 Sq metre
Assets and Structures to be acquired	<ul style="list-style-type: none"> i) Open land ii) Residential land iii) Houses, Fruit bearing and non fruit bearing trees including Coconut, mango and chikoo trees
Ownership of land	Privately owned
Classification of land	NA
Use of land	Residential and recreation

The objective of the study was to identify the social and economic impacts of the land acquisition for the proposed project on project affected families besides designing a social impact management plan SIMP as mitigation measures.

An inclusive approach was followed by the SIA team conducting discussions and public consultation meetings to gather the information on the issues and concerns of the project affected family (PAF). Data collection involved multiple step processes of site visits and field surveys. Afterwards, SIMP was developed to mitigate the social, economic and environmental impacts.

The potential negative impacts of the projects can be minimized by adopting mitigation measures. To mitigate economic impacts, the PAFs should be compensated as mandated under Section 26-31 of the RFCTLARR 2013 act. During the construction, development beautification phase, necessary precautions should be taken to reduce air pollution, noise pollution as people live around the proposed land acquisition site. This would mitigate the negative impact of the proposed project which are likely to be affected due to the acquisition of the land. Concerning environmental impacts, the proposed project should be designed in a way that beautification includes planting of fruit bearing and non-fruit bearing trees and plants found in the surrounding area of the fort. More tree plantation shall be undertaken on the project site to compensate for the loss of trees.

As per the detailed assessment, development work and beautification around Nani Daman Fort will have more positive than negative impacts on local population, and future generations. The social costs incurred by PAFs in terms of loss of land/property can be compensated mostly by taking proactive measures. There is no loss of livelihood as a result of the proposed land acquisition. The project will increase tourism and opportunities for the local population.

The discussions and interactions with stakeholders including the project affected families, public representatives, officials of government departments, and local people indicate that the project will prove to be a milestone for the beautification of the city and growth and development of tourism.

The SIA team is unanimous to state that PAF is ready to offer the land for acquisition and it should be done as per the provisions of the RFCTLARR Act 2013. The government is suggested to balance environmental and social considerations, and benefits through the implementation of the proposed mitigation measures. It is recommended that preventive measures be given first consideration to reduce the cost of mitigation measures and at the same time minimize the negative impact of the project.

CHAPTER-1

DETAILED PROJECT DESCRIPTION

1.1 ABOUT THE PROJECT

The proposed land acquisition project is for development work and beautification around Nani Daman Fort. The project aims to acquire 1151 Sq metre in the vicinity of Nani Daman Fort. The purpose of the acquisition of land is to create pathways and develop the space as one of the best tourist attractions in the city.

1.2 PROJECT BACKGROUND

The tourism development plans in Daman have been categorized under two main developments viz. Heritage Development Plan & Water Front Development Plan. Heritage and Water Front Tourism are also proposed to be the unique selling feature of the Daman region.

The Heritage development plan includes development plans for the Moti Daman Fort, Nani Daman Fort, heritage structures in Daman like Churches, old Portuguese buildings, etc. One of the major tourist products proposed is the heritage walk through the Moti Daman Fort area and surrounding Portuguese settlements, which would be further accentuated by products like heritage cuisine, cultural shows etc. Moti Daman & Nani Daman Fort is proposed to be conserved and developed so as to portray Daman as the city of Twin forts.

1.3 NECESSITY AND PURPOSE OF THE PROJECT

The proposed land acquisition is found to be necessary for as per the development perspective plan for Daman and Diu. Based on the past tourist arrivals, hence the proposed project holds significance for overall development planned for the region, the annual tourist traffic is estimated to increase to around 520,000 by the year 2022 growing at a CAGR of 8% per annum. Beautification and development of tourist places is essential for realizing the tourism potential of the twin city of Daman.

1.4 PROJECT LOCATION

The location of the project is shown in fig 2. The boundaries of the area to be acquired for the proposed project is in the vicinity of Nani Daman Fort as given below:

- **East-**Road for Back Entrance Gate of the Fort
- **West-** Residential Houses
- **North-** Residential Houses
- **South-** Nani Daman Fort

Fig 1: Project location





Fig 2: Project site



1.5 PROJECT COST

The estimated cost of the project is not known to SIA team

1.6 PROJECT ALTERNATIVE

The proposed project serves a public purpose. The SIA team is of the view that the proposed land acquisition is the most suitable considering the objectives of the project. No alternative land is suitable for the proposed development work and beautification of the Nani Daman Fort.

CHAPTER 2

TEAM COMPOSITION, APPROACH AND METHODOLOGY

SR Asia is an ISO 9001:2015 certified International Organization, registered under Section 8 of the Companies Act-2013 headquartered in India and has a presence in over 12 countries in the Asian region. SR Asia works in the sustainability domain and works with the government, public and private sector, and multilateral agencies. The organization has professionals who are qualified and have expertise in diverse disciplines functioning at all levels. The team consists of Management professionals, Economists, Social Scientists/anthropologists, etc. The organization has experience in conducting Social Impact Assessments in various states of the country. SR Asia is empaneled with various state governments such as Himachal Pradesh, Daman and Diu, Dadra and Nagar Haveli, Jharkhand, etc. for conducting SIA studies as per RFCTLARR-2013.

Section 4 of the RFCTLARR Act 2013 requires that all SIA studies undertake surveys /public consultations as part of the study. SIA aims to ensure that all stakeholders interested in a proposed project including project beneficiaries and the general public in the vicinity of the proposed project be identified and their opinion considered during the project planning, design, construction, operation, and decommissioning phase. In compliance with the requirements of the regulations, the SIA team conducted the assessment during October 2023 and interacted with PAFs, local self-government leaders, and other stakeholders of the current project. This chapter illustrates the approach and methodology adopted for undertaking the SIA and gives an overview of the SIA unit and the activity schedule of the study.

2.1 OBJECTIVES AND SCOPE OF STUDY

The SIA study was conducted with the following objectives:

- To assess whether the proposed land acquisition for the project would serve public purpose;
- To estimate the number of affected families, magnitude of land assets based on the actual holdings of the families and the number of families among them likely to be displaced physically or economically due to land acquisition;
- To identify the extent of lands, houses settlements and other common properties likely to be affected;
- To examine whether the extent of land proposed for acquisition is the bare minimum necessary;
- To find out whether an alternative site has been considered for the purpose;
- To study the social impacts of the project by covering both direct as well as the indirectly affected households due to loss of property, common property resources (CPRs), socio-

economic infrastructure etc. and the impact of these costs on the overall costs of the project vis-a-vis the benefits of the project;

- To suggest remedial intervention measures by designing appropriate policies and programmes through a social impact management plan or mitigation plan (SIMP).

2.2 TEAM COMPOSITION

SR Asia constituted a team led by Pradip Parsure (Project Coordinator) and local field investigators, etc was directed by Mr. Birendra Raturi. The team members are postgraduates in social work/sciences and well-versed in investigating social phenomena, undertaking interviews and questionnaire surveys, conducting group discussions, and PRA techniques to elicit information on the subject of inquiry. All the team members have prior experience in conducting SIA.

2.3 APPROACH AND METHODOLOGY

In view of the RFCTLARR Act 2013 all initiatives have been taken to fairly identify the rights of PAFs, PAPs and indirectly affected families and people to discuss the project in detail. The advantage the project will bring for directly and indirectly families and the opportunities the RFCTLARR Act 2013 brings to compensate PAPs fairly for their rights to compensate in fair and transparent manner of land acquisition.

The team has looked for the notification released by the office of collector, Daman to see that the impacted population is well informed prior to social impact assessment study. The project team has further utilized the opportunity for bringing the people's views, opinions, feedback, various means and mechanisms such as meeting public representatives, PAPs, one to one discussion, verification of PAPs complete details.


Further for minimizing the communication gaps a team of locally and trained by SR Asia experts were used to collect data, brief communities and bring maximum participation by organizing public meetings, personal interviews, focused group discussions, etc. The views, feedbacks and concerns of the PAPs have been highlighted to reflect the fundamentals of the act for maximum transparency and minimal modulation of the impact.

The approach to study the social impact of Acquisition of Land For Work Development and Beautification Around Nani Daman Fort was planned in a manner to cover the requirements. It involved a combination of qualitative and quantitative research methods such as desk research, public consultations with project affected population and public representatives, focus group discussions and Survey questionnaire.

2.3.1 Methods and tools used

A mix of qualitative and quantitative methods was used for the SIA study. These methods helped in understanding the profile of the town, the socio-economic profile of PAFs, the potential impact of this project, and mitigation measures that can be adopted to minimize the negative impacts of the project. The following methods and tools were adopted for the SIA study:

- Desk review
- Site visits
- A questionnaire using ZOHO survey App
- Stakeholders' Consultation
- Public Consultation/ focus group discussion
- Photography/videography using Time-Stamp Camera App.



2.3.2 Desk Review

The RFCTLARR Act 2013, available reports, project-related documents and records from the Department of Revenue and Land Reforms, and literature including maps, details of landowners, etc. were reviewed during the study. This was done to understand the socio-cultural and economic status of PAFs, the magnitude of the impact of the project, and measures that can be taken to mitigate the negative impacts of the project. Desk review also helped in developing tools for primary data collection.

2.3.3 Site Visit

The project team physically visited the land that was to be acquired to make an independent assessment of the resources on the project land and the land use pattern. Site visits also helped in assessing the potential impact on the land.

2.3.4 Questionnaire Survey and FGDs

To understand the socio-economic profile of affected families and all categories of impacts of the project, a questionnaire was prepared. The online questionnaire (prepared from the Zoho survey) consists of both open and close-ended questions eliciting information required as per the provision of the act. A sample of the questionnaire is attached as **Annexure 1** in the report. Also, Focused Group Discussions were conducted with the PAFs during site visits. These were further analyzed to give a holistic approach to the SIMP (Social Impact Management Plan).

2.3.5 Stakeholders' Consultation

To gain an in-depth understanding of the situation, stakeholders' consultation was conducted with the project affected families and officials of Collectorate, etc. Maps of the project site and other related documents were made available by the office of the Collectorate. These documents were used to understand the necessity of acquiring that land, and the benefits that this project will bring to the development of Daman, and its impact on the stakeholders. Details of discussions held are mentioned in the following chapter of the report.

A discussion was held with the PAFs on the background of the land and the potential impact of the project. The discussion helped in understanding the opinion of the PAFs regarding their land to be acquired for Work Development and Beautification Around Nani Daman Fort. During the consultation, PAFs shared their concerns and conditions regarding land acquisition.

The data obtained from questionnaire surveys and consultations were analyzed to provide a summary of relevant baseline information on affected populations; all categories of project impact which include the direct and indirect impact of physical and/or economic nature on the people and the general environment. The responses received through the consultation and socio-economic survey are represented in the subsequent chapters of this report.

2.4 Public Hearing

Section 5 of the RFCTLARR Act 2013 envisages that whenever an SIA study is required to be conducted, the government shall ensure that the public hearing should be held at the affected area to ascertain the views of affected families which are recorded and included in the SIA Report. RFCTLARR Act 2013 has prescribed detailed procedures for the conduct of the public hearing. Following the above, SR Asia will organize a public hearing as per the notification that will be issued by the District administration.

2.5 Schedule of SIA study

On receipt of confirmation of SIA work from the Land Acquisition Department (Dy. Collector officer- Daman), detailed planning of the project activities was worked out. As proposed in terms of reference (ToR), a work schedule was developed.

S. No	Activity	WEEKS							
		WK 1	WK 2	WK 3	WK 4	WK 5	WK 5	WK 7	WK 8
1	Team formation	█							
2	Desk Research	█							
3	Project Planning	█							
4	Training of field team		█						
5	Meeting with stakeholders			█					
6	Execution: Site visit			█					
7	Questionnaire survey				█				
8	Data Analysis					█			
9	Report Writing					█	█	█	
10	Submission of the draft report								█
11	Public Hearing								

12	Submission of Final Report								
----	----------------------------	--	--	--	--	--	--	--	--

2.6 Monitoring & Quality Assurance

- The project was monitored by the project team leader. The roles and responsibilities of different members of the project team were defined by the project leader before the start of the project.
- To finish the project in time, the work break-down structure was prepared identifying various activities and milestones.
- Scheduling of activities was done to define the start and end date of each activity and the milestones. This document was reviewed at regular intervals to check the status against the planned target date.

CHAPTER- 3

LAND ASSESSMENT

3.1 LAND REQUIRED FOR PROJECT

A total of 1151 Sq metre. of land is to be acquired for Work Development and Beautification Around Nani Daman Fort in Daman. The proposed project is a part of overall development of tourism in Daman and creating opportunities for growth of livelihood and other commercial opportunities for local people.

3.2 TYPE OF LAND AND SOIL

The land to be acquired is a residential cum open land consisting of around 10 trees and 30 plants. The soil of this area is brown.

3.3 LAND USE PATTERN

During field visit it was found that the land to be acquired is being used for residential purposes. In the affected area, there is no Common Property Resource (CPR). The PAF have owned the land through heredity and have been living for a very long time. No significant changes in the land use pattern and ownership were found during the site visit by the SIA team and interaction with PAFs.

3.4 LAND ASSESSMENT DETAILS

The project team visited the site location and verified the details provided by the Land Acquisition office. Details are mentioned in the table below:

Table 2: Land assessment details

Description	Land assessment and assets verification
<i>Land Ownership (proposed land to be acquired)</i>	As per LA notification, the said land belongs to the PAFs.
<i>Land use details of the area of operation of the proposed land</i>	As per PFA the project is already approved by the government on the said land which is sought under land acquisition by the DC Daman.

<i>Determining the necessity for land acquisition</i>	This project is required to beautification of Nani Daman fort and to undertake overall development of the tourist site. The proposed land is required to be acquired for developing pathways around Fort
<i>Common property resource (CPR)that may be disturbed due to proposed land acquisition</i>	Nil

3.5 OWNERSHIP OF LAND

The land to be acquired is privately owned by 7 families. Regarding the ownership of land, the PAF live on the same property. During the field survey, the extent of impact was also analyzed. As data obtained from the survey, PAFs are partially affected by acquisition.

3.6 LAND AND AREA HOLDER

The SIA team gathered the information on projects and other details such as land etc. from the Collectorate Office. Further details are given below:

Table 3: Details of land area and land holder

Sr No	Village/ City Name	Survey No/ P.T.S/ Chalta No	Class of Land	Name of the person believed to be interested in land ownership	Area to be acquired in Sq metre
1	Nani Daman	47/148-A	NA	Banu Givan	62.00
2	Nani Daman	47/147	NA	Sukar Naran	14.00
3	Nani Daman	47/145	NA	Ramiben Vallabh Tandel Ganesh Vallabh Tandel Paresh Vallabh Tandel Ashwin Vallabh Tandel Hitendra Vallabh Tandel	1075.00
				Total	1151.00

CHAPTER-4

ESTIMATION AND ENUMERATION OF AFFECTED FAMILY

This chapter describes in detail the directly affected landowner and the impact of the Land acquisition for work development and beautification around Nani Daman fort on their families, properties, resources, etc. The proposed land is an open plot and there are a few structures at the proposed land since the project will have immediate impact on their family and resources. As mentioned above, 1151 Sq metre of land to be acquired is spread over 3 survey numbers, which will be impacted by the development of the project.

4.1 NUMBER OF RESIDENCE/AFFECTED STRUCTURES

The land to be acquired is used for residential purposes. The table below briefly describes the estimation of the affected property.

Table 4: Number of residence/affected structure

S. No	Category of loss	Description
1	Total Land Area	1151 Sq metre
2	Structures	Pakka House structure found with boundary wall
3	Livelihood	No loss of livelihood as a result of the project
4	Common Property Resource	Nil
5	Any Others (cultural heritage)	Nil

4.2 LOSS OF COMMON PROPERTY

The common property will not be affected by the acquisition of land for work development and beautification around Nani Daman fort.

Table 5: Loss of common property

S No	Particulars	Total Number
------	-------------	--------------

1	Temple	Nil
2	Masjid / Gurudwara/Church	Nil
3	Hand Pump	Nil
4	Transformer	Nil
5	Electric poles	Nil
6	Water Bodies	Nil
7	Government Structures	Nil
8	Educational Institution	Nil
9	Drainage and sewer line	Nil

4.3 LOSS OF INDIVIDUAL ASSETS

Individual assets in the form of loss of land, structure and trees will be affected by the project. Details are mentioned in the table below:

Table 6: Loss of individual assets

S. No	Particulars	Total numbers
1	Residential Houses	2
2	Bore wells	1
3	Farm Ponds	Nil
4	Sheds	1
5	Compound walls	1
6	Water Tanks or hand pumps	Nil

7	Pipeline	Nil
8	Commercial establishments (Shops etc.)	Nil
9	Any other activity	1
10	Trees / Garden / Jarayat	Coconut, mango and other trees.
11	Commercial Plots for renting purpose	Nil

CHAPTER 5

SOCIO-ECONOMIC AND CULTURAL PROFILE

This chapter describes the socio-economic profile of the project area and the project-affected persons. This chapter specifically analyzes the impacts on land and other immovable assets based on a detailed survey done. Based on the impact on land, a sample survey was carried out at Daman and the results of the survey established the socio-economic status of PAF. PAF however has not agreed to share the social and economic information as was necessary to analyze the family social and economic status.

5.1 DEMOGRAPHIC PROFILE

Demographically, the U.T. of Daman and Diu comes in a higher middle-income group, which is also reflected in the socio-economic profile of the PAFs. As per 2011 census, total population of Daman district of Union Territory of Daman and Diu and Dadra and Nagar Haveli is given as follows;

Table 5.1: Demographic details of Population of U.T. of Daman & Diu

Category/ Tehsils	Details	Percentage (%)
Total population	1,91,173	100%
Males	1,24,659	61.78%
Females	66,514	38.22%
Total literacy	150, 348	88.07 %
Male	104, 316	91.61 %
Female	46, 032	80.98 %
Density/ Km2	2, 655 persons	
Distance from nearest railway station	30 kms (Vapi)	
Distance from nearest airport	About 130 Kms (Surat, Gujarat)	
Common fruits and vegetables grown	Coconut, Wheat, Rice, Groundnut, tamarind etc.	

Mode of irrigation	Hand pump engine, canal and tubewell etc.
Average monthly income of the PAFs	Rs. 24, 500


5.2 SOCIO-ECONOMIC PROFILE

Detailed socio-economic profiles of the PAFs including family details, demographic information on social classification, education, and occupation, family income, etc. are as follows

a) Age group

Findings show that around 60% of the respondents lie between the age group of 41-50 years. Out of total, 20% of respondents lie in the age group of 51-60 years whereas the remaining 20% of respondents lie in the age group of 31-40 years.


Graph 5.1: Age wise distribution of the Land Owners



b) Gender

Out of total respondents 60% were male and 40% of respondents were female


Graph 5.2: Gender wise distribution of the Land Owners



c) Social Group

All the PAFs belong to the Other Backward Class (OBC).


Graph 5.3: Social group wise distribution of the PAFs



d) Marital status

Following table shows that 60% of respondents are married and have kids whereas 20% of respondents were not married.


Graph 5.4: Marital status of the Land Owner



e) Religious group

All PAFs belong to Hindu religion.


Graph 5.5: Religious group of the PAFs



f) Family type and size

Around 80% families are nuclear in nature (having family members ranging from 2-4) and the rest of the 20% families are of medium sized nuclear families (having 5-7 family members).


Graph 5.6: Family Type and Size



g) Educational status

PAPs are well educated. Around 40% of respondents are graduates and post graduates. No PAPs are illiterate.

Graph 5.7: Educational status of the Land Owners




h) Main family occupation

The PAPs are involved in small business and Government service

i) Monthly family income

During the survey it is found that around 40% of families have monthly income from Rs 20000 to 50000 and another 40% of them have income from 50000 to 100000. This shows that the most of the PAF falls into high income group.


Graph 5.8: Monthly Family Income of PAFs



j) No. of earning members

Majority of families have only one earning family member. PAPs earning comes from either family business or Government service and rent of the land and shed they have.


Graph 5.9: No. of earning members of PAFs



k) Type of house structure

Around 80% of family members have pucca simple concrete houses whereas 20% of PAFs have single story buildings.

Graph 5.9: Type of house structure of PAFs



5.3 STAKEHOLDER CONSULTATION

The project team identified and consulted stakeholders of the project during the field visit. The consultation was carried out to understand the project in a better way and to gather different perspectives. Project affected people are of mixed view on the proposed project. Some of them are of the opinion that the development and beautification of Nani Daman will attract tourists and may help in increasing income opportunities for the people. However some of the stakeholders said that the footfall at the fort is very less compared to other tourist sites in Daman and may not have significant improvement with the proposed project. Hence Nani Daman fort needs comprehensive restoration and development.

CHAPTER 6

PUBLIC CONSULTATION

The Public consultation meeting was held at the project site during field visit. As a part of public consultation views and opinions of the PAPs, PAFs and other stakeholders were recorded. Issues discussed and deliberated with the stakeholders were also noted during the consultation process. Key issues identified during public consultation are mentioned in the following table.

Table 6.1: Key issues and Concern

Sr.no	Survey no.	Name	Issue raised	Stakeholder remarks
1	47/147	Bhawna Sukar	<p>We are willing to give our land But how much will be the compensation for the land and building structure?</p> <p>What kind of incentives does the government provide?</p> <p>How much time does it take to wind up entire process of Land Acquisition?</p> <p>We are happy to give entire plot under this survey number. If government is acquiring partially that may create a problem for its further usage.</p>	<p>The authority will verify and resolve the issue and concerns against the proposed land during public hearing</p>
2	47/145	Ashwin Wallabh Patel	<p>We request the district administration to rethink the boundary of proposed land acquisition.</p> <p>We are not aware about the compensation amount. Government should provide fair compensation for the land to be acquired</p>	<p>The authority will verify and resolve the issue and concerns against the proposed land during public hearing</p>

CHAPTER 7

SOCIAL IMPACT AND SOCIAL IMPACT MANAGEMENT PLAN

This Social Impact Management Plan (SIMP) has been prepared to mitigate negative social impacts of this project according to RFCTLARR. The SIMP consists of a set of mitigation, monitoring and institutional measures to be taken during the design, development and operational phases of the project to eliminate adverse social impacts or to reduce them to acceptable levels. The main aim of the SIMP is to ensure that the various adverse impacts are mitigated and the positive impacts are enhanced. The SIMP shall be implemented during the various stages of the project viz. Pre-development stage, development stage and operational stage.

In compliance with section 4 of the Right to Fair Compensation and Transparency in Land Acquisition, resettlement and rehabilitation Act of 2013, the present social impact assessment was carried out with the prime objective to identify the potential socio-economic positive and negative impacts of land acquisition and to develop attainable mitigation measures to enhance positive impacts and reduce or avoid negative impacts and thereby ensure a participative, informed and transparent process of land acquisition for the development work and beautification around Nani Daman fort.

APPROACH TO MITIGATION

The SIA team made use of a combination of research approaches i.e., quantitative and qualitative, for the identification of various social impacts and the mitigation measures. Adoption of a combination of both qualitative and quantitative methodology was intended to obtain a more comprehensive data and more holistic result without excluding any important area of assessment. The mitigation measures proposed were arrived at through a series of interactions and discussions with different categories of stakeholders, viz the project affected population, government officials of the Department of Revenue and Land Reforms. The collected information on social impact was studied and discussed internally and externally with experts in order to frame the mitigation plan. The process of such interactions culminated at framing various measures to mitigate and avoid or reduce the impact.

SOCIAL IMPACT

The area of the SIA study was limited to an extent of 1151 Sq metre. was possessed by 7 PAF. Information elicited through a multipronged strategy highlighted that most landholders were happy with the development work and beautification around Nani Daman fort. in the area identified. At the same time, they expressed certain concerns that could affect/impact their social and economic life in the society due to the acquisition of their land. The following provides the

major anticipated impacts (both positive and negative) of the proposed project which was discussed by the PAFs with the project team:

Positive Impacts

Responses highlighted that the development work and beautification of Nani Daman fort and surrounding area will have a positive impact on the people and the area considering potential growth and development of Tourism in Daman. A few of the major impacts are cited below:

a) Increase in land price

With the development work, the value of the landholdings around the Nani Daman fort, Daman is likely to increase.

b) Development of infrastructure

The construction of pathways and beautification work planned will lead to the overall development of the area in terms of providing a space for recreation purpose and will also create employment opportunities and scope for small business owners.

c) Employment opportunities

This is expected that during development and afterward there will be employment opportunities for skilled and unskilled people.

Negative Impacts

The construction activity will create many environmental hazards and even post construction proper facilities need to be built in to minimize any health and hygiene impacts.

a) Impact on Land

The land to be acquired is residential land hence there will not be any major negative impact on land. However concretization may lead to pollution in the area during the project development phase.

b) Impact on livelihood (Loss of source of income)

Acquisition of this land will not have any effect on the source of income as it is a residential area.

c) Impact on Physical resources (Loss of assets)

The acquisition will impact individual assets such as coconut trees, etc.

d) *Impact on environment*

The loss of trees in this area can also impact ecological diversity.

Table 7: Summary of positive and negative impact

Impact	Status of Impact	Negative/positive	Direct/Indirect	Temporary / permanent	Major/Minor
Loss of a source of income and project planned on this site by the PAFs	Yes	Negative	Direct	Permanent	Major
Increase in land price	Yes	Positive/negative	Direct	Permanent/temporary	Major
Loss of livelihood	No	Negative	Direct	Permanent	Major
Development of infrastructure	Yes	Positive	Direct	Permanent	Major
Pathway for tourists	Yes	Positive	Direct	Permanent	Major
Employment opportunities	Yes	Positive	Direct	Permanent	Major
Ease to access/decrease in migration	NA	Positive	Direct	Permanent	Major
Loss of trees present in the project site	Yes	Negative	Direct	Permanent/temporary	Minor
Employment opportunities during and post construction	Yes	Positive	Direct	Permanent	Major

Brand value to the Town, state, and district	Yes	Positive	Direct	Permanent	Minor
Impact on land	Yes	Negative	Direct	Permanent	Minor

SOCIAL IMPACT MITIGATION PLAN

Based on the desk review, field investigations, and consultations undertaken during the social impact assessment study for the development work and beautification of Nani Daman fort, following Social Impact Mitigation Plan (SIMP) has been developed to mitigate negative social impacts. Social impacts, loss of assets and loss of trees were found to be the major negative impacts of the project. However, all can be implicitly managed with possible benevolent intentions. In this regards, the following mitigation measures can be adopted:

Economic measure

- a) Loss of property and the assets due to acquisition of land should be compensated as mandated by the Act under sections 26-31 and which are listed in the First Schedule of the Act for the one household.

Rehabilitation Measures

- a) There are residential houses and construction establishments partially at the project site. However no R&R is recommended.

Other measures

- a) A public redressal mechanism should be designed at the project site to address the concerns of the directly affected population (if any) during the project development stage.
- b) The landowners shall be suitably compensated
- c) Construction materials & waste should be properly covered/ disposed of during transportation to avoid spillage & dispersion in and anywhere else.
- d) Due instructions and signage shall be provided for the site workers/truck/vehicle drivers and other staff to limit noise in general such as the use of horns, noise-making equipment, and processes.
- e) All precautions shall be taken during the construction phase not to hamper and disturb locals.

MEASURES TO AVOID, MITIGATE AND COMPENSATE

The proponent should ensure that preventive measures are taken to address the issues. A redressal system may be set up with representatives from the revenue department, Panchayat, and the proponent for the speedy settlement of the unanticipated issues that may cope up during various stages of the project. Comparing/weighing the positive against the negative impacts, it can be easily concluded that the former outweighs the latter reaffirming the identified site as the most suitable and apt one for the development work and beautification around Nani Daman fort. It is observed that although the landholders for sure lose partial land, their quality of life is likely to get affected. It is also observed by the SIA team that many of the negative impacts highlighted above can be minimized or reduced further with appropriate and effective mitigation measures/strategies mentioned above.

CHAPTER 8

COST AND BENEFIT ANALYSIS

After careful analysis of the positive and negative impacts of the proposed project of development work and beautification around Nani Daman fort, the SIA team compared the cost with its benefits. In the following section, a detailed analysis of benefits and respective costs is presented. The specific cost of the project was made available but as the provisions are estimated and are not exact, hence the exact cost-benefit analysis is not being carried out.

8.1 ASSESSMENT OF PUBLIC PURPOSE

The proposed project is in the interest of the general public as it will have a positive impact on tourism sector and growth of local economy and serves a public purpose to increase small business and livelihood opportunities in the area of Daman. The project will prove fruitful for the entire community spread over a large area in Daman. It can further be established that the public purpose will be certainly served by acquiring the private land and thereby, completing the proposed activities of the project. Hence, the social costs and benefits of the proposed land acquisition have been assessed assuming that there will be no change in the location of the project or the quantum of land that will be acquired.

8.2 IMPACTS ON STRUCTURES AND ITS MAGNITUDE

There are few structures like shed, house wall etc. on the land to be acquired.

8.3 DETERMINANTS OF COMPENSATION

As per sections 26 and 27 of RFCTLARR-2013, the collector shall adopt the following criteria to assess and determine the market value of land and the amount of compensation. Market value specified in the Indian Stamp Act, 1899, for the registration of sale deeds or agreement to sell where land is situated, the average sale price of similar type of land situated in the nearest village or nearest vicinity.

As per them, such rates have already been paid by other builders/buyers in the same area. The compensation should be made keeping in mind the provisions of the RFCTLARR-2013 act.

8.4 ENTITLEMENT MATRIX

The PAFs will be entitled to the following types of compensation and assistance packages:

- Compensation for the loss of land, crops/ trees at their replacement cost;

- Compensation for structures if any and other immovable assets at their replacement cost;
- Assistance in lieu of the loss of business/ wage income and income restoration assistance;
- Assistance for shifting and provision for the relocation site (if required), and
- Rebuilding and/ or restoration of community resources/facilities

As per sections 26 and 27 of RFCTLARR-2016, the collector shall adopt the following criteria to assess and determine the market value of land and the amount of compensation. Market value specified in the Indian Stamp Act, 1899, for the registration of sale deeds or agreement to sell where land is situated.

- The average sale price of a similar type of land situated in the nearest village or nearest vicinity,
- Consented amount of compensation as agreed upon under subsection (2) of section 2 in case of acquisition of lands for private companies
- R& R package as per RFCTLARR-2013

The below table shows the Entitlement Matrix according to the category of the impact and the eligibility of R&R as per RFCTLARR. The basic principles governing compensation structure are shown below:

Table 8 Basic Principles Governing Compensation Structure

S. No	Category of Impact	Eligibility for Entitlement	Relevant RTFCTLARR Act 2013	
1	Loss of Land	Titleholder	The market value of the land. This will be determined as per Sections of RFCTLARR Act 2013 by DC. An amount equivalent to current stamp duty and registration charges on Compensation amount for replacement of lost assets	Applicable as per RTFCTLARR Act 2013.
		Affected family/person Land	Land for Land	Applicable as per RTFCTLARR Act 2013.
2	Loss of other immovable Assets	Title Holder	Value of Assets attached to land or building	This will be provided to affected families as per the RTFCTLARR Act 2013 (provision under First

				Schedule Sl.No.2 (ref. Section 29 of the said Act). This will be provided along with the loss of land and/or the structure which will be finalized by the Collector
3	Loss of Land and other assets	Title Holder	Additional 12% on the market value of land	Value of land, additional 12% per annum to be paid on such market value commencing on and from the date of publication of notification of SIA u/s (2) of section 4 in respect of land, till award or date of taking Possession of land Whichever is earlier.

8.5 CRITERIA FOR COMPENSATION BASED ON QUALITY OF SOIL/LAND

PAF should get compensation as per the current market rate and loss of assets compensate amount should be given if the same is being acquired. The Land and Revenue Department, Govt. of Daman will decide the appropriate compensation as per the RFTLARR 2013.

8.6 COST ESTIMATION OF LAND

The district administration Daman has classified different circle rates for each category in Daman. The final compensation should be decided in consent with the PAF and as per the RFTLARR 2013.

Land Cost Estimation

The land to be acquired is fully open and cultivated land. Therefore, the land cost will be decided accordingly.

8.7 CONDITIONS AND RECOMMENDATIONS FOR THE ACQUISITION OF LAND

Comparing the impact of the social costs of the project vis-a-vis the benefits that will accrue to the community once the project is completed; the SIA Team submits the following -

- The project fulfills the criteria set by sub-section (4) of section 4 of RFCTLARR Act, 2013, which requires that the project serves the public purpose and the bare minimum amount of land is being acquired for it.
- The costs that will be incurred by the potential PAHs and environment can be mitigated are not completely irreplaceable.
- Therefore, land can be acquired as requested by the Requiring Body so that the project can be completed.

However, the acquisition of land should be subject to the conditions and recommendations laid down below and given in the Social Impact Management Plan and other relevant chapters of this report, which in turn, are based on the above cost-benefit analysis.

8.8 COMPENSATION AMOUNT AWARDED TO THE LANDOWNERS BASED ON GOVERNMENT APPROVED RATE OF LAND

The compensation amount should be proper and as per the law. Besides, it should be beneficial for the land and structure owners who will lose their land and structures. The District Collectors should obtain this price information from the local land revenue department and should actively consider it while determining the existing value of land as per Section 26(1) of the RFCTLARR Act, 2013.

Valuation and Compensation for Immovable Assets

Immovable assets belonging to the landowners such as trees will be affected if the land is acquired. It is recommended that the valuation and compensation of these immovable properties should be based on sections 28 and 29 of RFCTLARR Act, 2013.

Restoration of Livelihood of Affected Persons / Households

The affected households are likely to lose a part of their land. It is recommended that adequate financial and material support should be provided by the requiring body to restore their livelihoods if the land is acquired. The support should be provided at least to the level that incomes are restored to the pre-project levels and their overall wellbeing is improved after the acquisition.

CHAPTER 9

PUBLIC HEARING

Section 5 of the RFCTLARR Act 2013 envisages that whenever an SIA study is required to be conducted, the government shall ensure that the public hearing should be held at the affected area to ascertain the views of affected families which are recorded and included in the SIA Report. RFCTLARR Act 2013 has prescribed detailed procedures for the conduct of the public hearing. Following the above, SR Asia will organize a public hearing as per the notification that will be issued by the District administration. Place and time of public hearing will be disseminated through the said notification and publication of the same in newspapers.

The Public hearing will be held as per the notification that will be issued by the collectorate, Daman. The objective of the public hearing will be to receive feedback, objections and suggestions from the PAFs and other stakeholders on the draft SIA report. Accordingly as per provision 8(1) Rights to fair compensation and transparency in land acquisition rehabilitation and resettlement Act 2013 will be exercised. The objections provided in written and verbal forms by the project affected people to the SIA team will be recorded during the public hearing.

CHAPTER 10


RECOMMENDATIONS

After careful analysis of the data collected through a questionnaire, interview with the PAF, and meetings with officials and site visit, the project team has developed the following recommendations.

- The proposed land can be acquired however compensation shall be made considering the market value of the land so that PAP/ PAFs are minimally affected.
- All the provisions of schedule 2 of the RFCTLARR-2013 should be considered.
- As per the analysis, the proposed land was found to be suitable for the project. District administration may engage with the project affected families to discuss the terms and conditions and may come up with an amicable solution for the successful completion of the proposed project.
- Some of the PAPs are willing to give their land for the proposed project if they are granted permission to set up shops and other commercial activities around the Nani Daman Fort. Therefore, PAPs may be permitted to set up shops in the nearby area to benefit from the proposed development work and beautification around Nani Daman Fort.
- Necessary arrangements may be made to reduce the impact during construction or development stage.


PHOTO GALLERY





Draft SIA Report on Acquisition of Land for Work Development and Beautification Around Nani Daman Fort.





REFERENCES

1. Right to Fair and Transparent Compensation in Land Acquisition, Rehabilitation, and Resettlement Act 2013
2. District Daman census handbook (2011)
(https://censusindia.gov.in/2011census/dchb/2502_PART_B_DCHB_DAMAN.pdf)
3. Daman Wikipedia profile (https://en.wikipedia.org/wiki/Daman,_India)
4. Final report On 20-year perspective plan for Daman & Diu, Market Research Division, Department of Tourism, Ministry of Tourism and Culture, Government of India
<https://tourism.gov.in/sites/default/files/2020-04/daman%26diu2.pdf>

ANNEXURES

Annexure 1: Survey questionnaire

सामाजिक/आर्थिक सर्वेक्षण प्रश्नावली

प्रश्नावली सं०

1. सामान्य पहचान (General Identification)

उष परियोजना का नाम :			
सर्वेक्षण/सत्यापन दिनांक		स्थिति (वाहिने/बाएं हाथ की ओर)	
गांव/कस्बा		ग्राम पंचायत/नगरपालिका	
तहसील		जिला	
पहचान सं०		चैनेज सं०	

2. प्रभावित परिवार की पहचान (Identification of AF)

भू-स्वामी/संरचना मालिक का नाम	
पिता/पति का नाम	
संपर्क नं०	

3. भू-स्वामी/संरचना मालिक के बैंक खाते का विवरण (Bank details of Land Owner/Structure Owner)

बैंक खाता नं०	
बैंक/शाखा का नाम IFSC कोड सहित	

4. भूमि का स्वामित्व (Ownership of the Land)

(1) निजी (2) सरकारी (3) धार्मिक (4) अन्य

5. भूमि का प्रयोग (Use of Land)

(1) खेती (2) बगीचा (3) आवासीय (4) व्यवसायिक (5) अन्य

6. कृषि भूमि का वर्गीकरण (Classification of Agricultural Land)

- (1) सिंचित (2) असिंचित (3) बंजर (4) अन्य

7. प्रभावित परिवार की श्रेणी (Category of AF)

- (1) मू-स्वामी (2) अतिक्रमणकारी (3) उपवेशी (4) किरायेदार
(5) दिहाड़ी मजदूर (6) क्योरक (7) बटाईदार (8) अन्य

8. परिवार प्रश्नावली (Household Schedule)

(क) उत्तरदाता का नाम :

(ख) उत्तरदाता का मू-स्वामी/संरचना मालिक के साथ सम्बन्ध :

(ग) परिवार का प्रकार:-

- (1) एकल (2) संयुक्त (3) अन्य

(घ) धार्मिक समूह:-

- (1) हिन्दू (2) मुस्लिम (3) सिक्ख (4) इसाई (5) जैन (6) बौद्ध (7) अन्य

(ङ) सामाजिक स्तर:-

- (1) अनु० (2) अनु० जनजाति (3) अन्य पिछड़ी जाति (4) सामान्य जाति जाति

(च) परिवार का विवरण (Household Particulars of Family)

क्र० सं०	परिवार के सदस्यों के नाम (पहला नाम मू-स्वामी/संरचना मालिक)	मू-स्वामी /संरचना मालिक से सम्बन्ध	लिंग (पु०/ म०)	उम्र	शिक्षा	वैवाहिक स्थिति	मुख्य आय प्रतिविधि	आय प्रतिमाह	विकलांगता (शारीरिक या मानसिक)
1	2	3	4	5	6	7	8	9	10
1.									
2.									
3.									
4.									
5.									
6.									

7.									
8.									
9.									
10.									
11.									

9. केवल भू-स्वामियों के लिए (Only for the Title Holders)

प्रभावित भूमि का विवरण (Details of affected Land)

- (1) खाता सं० :
- (2) खसरा सं० :
- (3) प्रभावित भूखण्ड का कुल क्षेत्रफल (हे० में) :
- (4) प्रभावित भूखण्ड का प्रभावित क्षेत्रफल (हे० में) :

10. संरचना का विवरण (Details of affected Structure)

(क) सड़क के प्रस्तावित मध्य से संरचना की दूरी (मी० में)

(ख) प्रभावित संरचना का प्रयोग (Use of affected Structure)

(1) आवासीय (2) व्यवसायिक (3) आवासीय एवं व्यवसायिक (4) अन्य (लिखिये)

(ग) संरचना/ढांचे का मालिकाना हक

(1) निजी (2) सरकारी (3) धार्मिक (4) सामुदायिक (5) अन्य

11. (क) यदि आप विस्थापित होते हैं तो आप कहाँ बसना चाहेंगे ? (स्थल का विवरण दें)

(ख) संरचना की अनुमानित लागत (रु० में)

12. संरचना की माप (मी० में)

संरचना की माप	लम्बाई	चौड़ाई	ऊँचाई
संपूर्ण क्षेत्रफल			
प्रभावित क्षेत्रफल			

13. संरचना का प्रकार

(1) पक्का (2) कच्चा (3) अर्धपक्का (4) अन्य

14. संरचना में प्रयुक्त निर्माण सामग्री का विवरण

छत

आर०सी०सी०	आर०बी०सी०	खपरैल	लकड़ी, ईट और मिट्टी	पत्थर	अन्य उल्लेख कीजिए

दीवार

ईट सीमेन्ट	ईट, सुखी और चूना	ईट मिट्टी	मिट्टी	पत्थर	अन्य उल्लेख कीजिए

फर्श

पत्थर की मिट्टी का पक्का फर्श	ईट की मिट्टी का पक्का फर्श	सोलिंग/खड़जा	पत्थर की पटिया का फर्श	कच्चा फर्श	अन्य उल्लेख कीजिए

15. आवासीय संरचना (Residential Structure)

- (1) संरचना कितनी पुरानी है ? (वर्षों में)
- (2) क्या कोई किसान/दादा है ? (1. हाँ/2. नहीं)
- (यदि हाँ तो इसका विवरण तालिका संख्या 16 में अंकित करें)
- (3) क्या गृह कर दे रहे हैं ? (1. हाँ/2. नहीं)
- (4) क्या बिजली है ? (1. हाँ/2. नहीं)
- (5) क्या पानी का कनेक्शन है ? (1. हाँ/2. नहीं)
- (6) यदि पानी का कनेक्शन नहीं है, तो पीने के पानी का क्या स्रोत है ?
- (7) क्या शौचालय की सुविधा है ? (1. हाँ/2. नहीं)
- (8) खाना पकाने के लिए ईंधन की क्या सुविधा है ?

19. केवल बटाईदारों के लिए (Only for Share Cropper)

क्र० सं०	नाम	कार्य करने की अवधि	बटाई की भूमि हे० में	औसत उपज का मूल्यांकन (रु० में)	औसत उपज में भागीदारी % में
1.					
2.					
3.					

20. प्रभावित परिवार अन्तर्गत वस्तुधन स्वामित्व विवरण (Detail of Live Stock Owned by AF)

क्र०सं०	पशुओं का नाम	कुल संख्या	क्र०सं०	पशुओं का नाम	कुल संख्या
1.	गाय		6.	घोड़ा	
2.	भैंस		7.	हार्थी	
3.	ऊँट		8.	भेड़	
4.	गधा		9.	बैल	
5.	बकरी		10.	अन्य	

21. प्रभावित परिवार के स्वामित्व अन्तर्गत अन्य संपत्तियों का विवरण (Detail of Other Assets Owned by AF)

क्र०सं०	संपत्तियों का नाम	कुल संख्या	क्र०सं०	संपत्तियों का नाम	कुल संख्या
1.	साइकिल		6.	वॉशिंग मशीन	
2.	दो पहिया वाहन		7.	कंप्यूटर	
3.	चार पहिया वाहन		8.	मोबाइल/लैंडलाइन फोन	
4.	गैस कनेक्शन		9.	ट्रैक्टर	
5.	टेलीविजन		10.	अन्य	

22. क्षमता वर्धन हेतु प्रशिक्षण के लिए विकल्प (Alternative for Training's)

1. प्रशिक्षण ट्रेड के लिए विकल्प
2. प्रशिक्षण लेने वाले रादरय का नाम व उम्र
3. क्या प्रशिक्षण के उपरान्त सम्बन्धित रोजगार अपनाना चाहेंगे ? (हाँ / नहीं)
4. क्या स्वरोजगार आपकी प्राथमिकता होगी ? (हाँ / नहीं)

23. प्रमाण-पत्रों का सत्यापन :-

- | | | | | | |
|----------------------|---|---|------------------------|---|---|
| (1) आधार कार्ड | [|] | (2) राशन कार्ड | [|] |
| (3) चुनाव पहचान-पत्र | [|] | (4) पंजीकृत किरायानामा | [|] |

- (5) बैंक पासबुक [] (6) पंचायत प्रमाण-पत्र []
 (7) इकरारनामा/नोटरी [] (8) अन्य (लिखिए) []

24. विपन्न परिवार का सत्यापन :-

- (1) बीपीएल [] (2) वृद्ध []
 (3) अनुसूचित जाति [] (4) अनुसूचित जनजाति []
 (5) विकलांग [] (6) महिला मुखिया परिवार []

25. Identified or Verified from PAP:-

लिंगानुपात संवर्धन (Gender Promotion)

1.	क्या आप के घर में पत्नी का बैंक खाता है ? यदि हाँ तो एकल है या संयुक्त	एकल	संयुक्त
2.	क्या आपके घर में महिलाओं की समान रूप से क्रय विक्रय, अथवा समस्याओं के निराकरण इत्यादि में निर्णायक भूमिका की सहमति ली जाती है ?	हाँ	नहीं
3.	क्या आपके घर में महिला सदस्यों की उच्च शिक्षा हेतु सहमति है?	हाँ	नहीं
4.	घर की कोई महिला सदस्य स्वयंसहायता समूह इत्यादि की सदस्य है?	हाँ	नहीं
5.	घर की कोई महिला सदस्य, ग्राम पंचायत की सदस्य है?	हाँ	नहीं
6.	घर की कोई महिला सदस्य किसी भी प्रकार के व्यवसाय/नौकरी में सम्मिलित है?	हाँ	नहीं
7.	घर की महिला सदस्यों के नाम से किसी भी प्रकार की प्रापर्टी/सम्पति/चल-अचल सम्पति क्रय की गयी है?	हाँ	नहीं
8.	क्या आप अपने परिवार में महिलाओं को क्षमता संवर्धन हेतु ट्रेनिंग/प्रशिक्षण दिलवाना चाहते हैं?	हाँ	नहीं

उत्तरदाता का नाम : हस्ताक्षर दिनांक

पर्यवेक्षक का नाम : हस्ताक्षर दिनांक

पी०डब्लू०डी० प्रतिनिधि का नाम : हस्ताक्षर दिनांक

ड्राफ्ट सोशियल इम्पेक्ट असेसमेन्ट रिपोर्ट

नानी दमड़ा किल्लानी आसपास कामना विकास अने व्युटीइकेशन
माटे जमीननुं संपादन



आने सळमिट कर्युं:
दमड़ा जिल्ला कलेक्टर

आना द्वारा तैयार:
असेआर अशिया,
4-CS-25, अंसल प्लाजा, वैशावी, सेक्टर-1,
गाजियाबाद-201010, उत्तर प्रदेश

સ્વીકૃતિ

નાની દમણ કિલ્લાની આસપાસના કામના વિકાસ અને બ્યુટિફિકેશન માટે જમીન સંપાદન માટેનો આ સામાજિક અસર મૂલ્યાંકન (SIA) રિપોર્ટ જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, 2013માં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકાર મુજબ એસઆર એશિયા દ્વારા ચલાવવામાં આવેલા કાર્યનું પરિણામ છે. SIA ટીમે સ્થાનિક ઇકોલોજી, સંસ્કૃતિ અને સામાજિક-આર્થિક પ્રોફાઇલ પરના મૂલ્યવાન ઇનપુટ્સ, ડેટા એકત્ર કરવા માટે મહેસૂલ અને જમીન સુધારણા વિભાગના અધિકારીઓ, લોક પ્રતિનિધિઓ અને દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ, દમણના પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારો (PAFs) સાથે વ્યાપક પરામર્શ કર્યો હતો.

અમે દમણ કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓને તેમના સતત સમર્થન અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

અમે પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારો (PAFs) અને સ્થાનિક પ્રતિનિધિઓ સહિત SIA અભ્યાસના તમામ ઉત્તરદાતાઓના સમય અને પ્રતિસાદ માટે આભારી છીએ. અમે આ અભ્યાસના તમામ સહભાગીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરીએ છીએ અને તેમના સમર્થન માટે તેમનો આભાર માનીએ છીએ.

બિરેન્દ્ર રતુરી
(આંતરરાષ્ટ્રીય નિર્દેશક)
એસઆર એશિયા

સંક્ષેપ

CPR	સામાન્ય મિલકત સંસાધનો
ડી એન્ડ ડી	દમણ અને દીવ
DNH	દાદરા અને નગર હવેલી
ડીપીઆર	વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ
FGD	કેન્દ્રિત જૂથ ચર્ચા
LA	જમીન સંપાદન
LAP	જમીન સંપાદન યોજના
NA	લાગુ પડતું નથી
PAFs	પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારો
PAPs	પ્રોજેક્ટ અસરગ્રસ્ત વસ્તી
આર એન્ડ આર	પુનર્વસન અને પુનર્વસન
RFCTLARR 2013 જમીન	સંપાદન પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, 2013 માં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર
SIA	સામાજિક અસર આકારણી
SIMP	સોશિયલ ઇમ્પેક્ટ મેનેજમેન્ટ પ્લાન
UT	કેન્દ્રશાસિત પ્રદેશ

સામગ્રી કોષ્ટક

સ્વીકૃતિ	1
સંક્ષેપ	2
એકિક્ઝ્યુટિવ સારાંશ	5
1. વિગતવાર પ્રોજેક્ટ વર્ણન	7
1.1 પ્રોજેક્ટ વિશે	7
1.2 પ્રોજેક્ટ પૃષ્ઠભૂમિ	7
1.3 પ્રોજેક્ટની આવશ્યકતા અને હેતુ	7
1.4 પ્રોજેક્ટ સ્થાન	8
1.5 પ્રોજેક્ટની કિંમત	9
1.6 પ્રોજેક્ટ વૈકલ્પિક	9
2. ટીમની રચના, અભિગમ અને પદ્ધતિ	10
2.1 અભ્યાસના ઉદ્દેશો અને અવકાશ	10
2.2 ટીમ રચના	11
2.3 અભિગમ અને પદ્ધતિ	11
2.3.1 ની પદ્ધતિઓ અને સાધનો અભ્યાસ	12
2.3.2 ડેસ્ક સમીક્ષા	12
2.3.3 સાઈટ વિઝિટ	12
2.3.4 પ્રશ્નાવલી સર્વે અને FGDs	13
2.3.5 હિતધારકોની પરામર્શ	13
2.4 જાહેર સુનાવણી	
13 2.5 SIA અભ્યાસ ની સૂચિ	14
2.6 મોનીટરીંગ અને ગુણવત્તા ખાતરી	15
3. જમીન આકારણી	16
3.1 પ્રોજેક્ટ માટે જરૂરી જમીન	16
3.2 જમીન અને જમીનનો પ્રકાર	16
3.3 જમીન ઉપયોગ પેટર્ન	16
3.4 જમીન આકારણી વિગતો	16
3.5 જમીનની માલિકી અને અસરની હદ	17
3.6 જમીન વિસ્તાર અને જમીન ધારકો	17
4. કૌટુંબિક સંપત્તિનો અંદાજ અને ગણતરી	18

4.1 રહેઠાણની સંખ્યા અને અસરગ્રસ્ત માળખાં	18
4.2 સામાન્ય મિલકતનું નુકસાન	18
4.3 વ્યક્તિગત અસ્કયામતોનું નુકસાન	19
5. સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક પ્રોફાઇલ	21
5.1 વસ્તી વિષયક પ્રોફાઇલ	21
5.2 સામાજિક-આર્થિક પ્રોફાઇલ	22
5.3 હિતધારકોની પરામર્શ	27
6. જાહેર પરામર્શ	28
7. સામાજિક અસર અને સામાજિક અસર વ્યવસ્થાપન યોજના	29
7.1 શમન માટે અભિગમ `	29
7.2 સામાજિક અસર	29
7.5 સામાજિક અસર વ્યવસ્થાપન યોજના	32
7.6 ટાળવા, ઘટાડવા અને વળતર આપવાનાં પગલાં	33
8. ખર્ચ અને લાભનું વિશ્લેષણ	34
8.1 જાહેર હેતુનું મૂલ્યાંકન	34
8.2 માળખાં પર અસર અને તેની તીવ્રતા	34
8.3 વળતરના નિર્ધારકો	34
8.4 હકદારી મેટ્રિક્સ	34
8.5 જમીન/જમીનની ગુણવત્તાના આધારે વળતર માટેના માપદંડ	36
8.6 જમીનની કિંમત અંદાજ	36
8.7 જમીન સંપાદન માટેની શરતો અને ભલામણો	37
8.8 જમીનના સરકાર દ્વારા મંજૂર દરના આધારે જમીન માલિકોને આપવામાં આવેલ વળતરની રકમ	37
9. જાહેર સુનાવણી	38
10. ભલામણો	39
ફોટો ગેલેરી	40
સંદર્ભો	44
જોડાણ	45

કાર્યકારી સારાંશ

પ્રવાસન વિભાગ, દમણ નાની દમણ કિલ્લાની આસપાસના વિકાસ કાર્ય અને વ્યુટિફિકેશન માટે પ્રોજેક્ટ હાથ ધરે છે. દમણ અને દીવના યુટી એડમિનિસ્ટ્રેશને દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારમાં કિલ્લાને અડીને 1151 ચોરસ મીટર જમીન સંપાદન કરવાનો નિર્ણય લીધો હતો. ઓળખાયેલ સ્થાન કિલ્લાની બાઉન્ડ્રી વોલની નજીક અને કિલ્લાની પાછળની બાજુએ આવેલું છે. સંપાદિત કરવાની સૂચિત જમીન જમીન ઉપયોગ પેટર્ન NA સાથે રહેણાંક પ્રકૃતિની છે. તેમાં બિલ્ડીંગ સ્ટ્રક્ચર્સ, ઘરની દીવાલો અને નાળિયેર, આંબાના ઝાડ જેવા લગભગ 10 ફળ ધરાવતાં વૃક્ષો અને ફૂલોના લગભગ 40 છોડ અને અન્ય બિન-ફળ ધરાવતાં વૃક્ષોનો સમાવેશ થાય છે.

કલમ 4 નિયમ 3 હેઠળ 10/10/2023 ના નોટિફિકેશન નંબર 3/118/LND-ACQ/2023-24/ 3748 મુજબ કુલ જરૂરી જમીન 1151 ચોરસ મીટર છે અને તેની માલિકી સાત PAPની છે. જમીનની માલિકી આનુવંશિકતા દ્વારા છે. પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવાર (PAF) મોટાભાગે રહેણાંક હેતુઓ માટે જમીનનો ઉપયોગ કરે છે. વધુ વિગતો નીચે મુજબ છે.

કોષ્ટક 1.1: જમીન અને વિશેષતાઓની વિગતો

સર્વેક્ષણ માટે PAF ની સંખ્યા	3
સંપાદિત કરવાની જમીનનું કદ	1151 ચોરસ મીટર
હસ્તગત કરવાની મિલકતો અને માળખાં	i) ખુલ્લી જમીન ii) રહેણાંક જમીન iii) , કેરી અને ચીકુના વૃક્ષો સહિત ઘરો, ફળો અને ફળ ન આપતા વૃક્ષો
જમીનની માલિકી	ખાનગી માલિકીની
જમીનનું વર્ગીકરણ	એન.એ
જમીનનો ઉપયોગ	રહેણાંક અને મનોરંજન

અભ્યાસનો ઉદ્દેશ પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારો પર સૂચિત પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની સામાજિક અને આર્થિક અસરોને ઓળખવાનો હતો ઉપરાંત સામાજિક અસર વ્યવસ્થાપન યોજના SIMP ને શમન પગલાં તરીકે ડિઝાઇન કરવાનો હતો.

પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવાર (PAF) ના મુદ્દાઓ અને ચિંતાઓ પર માહિતી એકત્ર કરવા માટે SIA ટીમ દ્વારા ચર્ચાઓ અને જાહેર પરામર્શ બેઠકો હાથ ધરવા માટે એક સમાવેશી અભિગમ અપનાવવામાં આવ્યો હતો. ડેટા કલેક્શનમાં સાઇટ વિઝિટ અને ફિલ્ડ સર્વેની બહુવિધ સ્ટેપ પ્રક્રિયાઓ સામેલ છે. પછીથી, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય અસરોને ઘટાડવા માટે SIMP વિકસાવવામાં આવી હતી.

પ્રોજેક્ટની સંભવિત નકારાત્મક અસરોને ઘટાડવાના પગલાં અપનાવીને ઘટાડી શકાય છે. આર્થિક પ્રભાવોને ઘટાડવા માટે, PAF ને RFCTLARR 2013 અધિનિયમની કલમ 26-31 હેઠળ ફરજિયાત વળતર આપવું જોઈએ. બાંધકામ, વિકાસના વ્યુટીફિકેશન તબક્કા દરમિયાન, વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ કારણ કે સૂચિત જમીન સંપાદન સ્થળની આસપાસ લોકો રહે છે. આનાથી સૂચિત પ્રોજેક્ટની નકારાત્મક અસર ઓછી થશે જે જમીનના સંપાદનને કારણે પ્રભાવિત થવાની સંભાવના છે. પર્યાવરણીય અસરોને ધ્યાનમાં રાખીને, સૂચિત પ્રોજેક્ટની રચના એવી રીતે થવી જોઈએ કે વ્યુટીફિકેશનમાં કિલ્લાની આસપાસના વિસ્તારમાં જોવા મળતાં ફળો ધરાવતાં અને બિન-ફળ વિનાનાં વૃક્ષો અને છોડનાં વાવેતરનો સમાવેશ થાય છે. વૃક્ષોના નુકશાનની ભરપાઈ કરવા પ્રોજેક્ટ સાઇટ પર વધુ વૃક્ષારોપણ હાથ ધરવામાં આવશે.

વિગતવાર મૂલ્યાંકન મુજબ, નાની દમણ કિલ્લાની આસપાસના વિકાસ કાર્યો અને વ્યુટીફિકેશનની સ્થાનિક વસ્તી અને ભાવિ પેઢીઓ પર નકારાત્મક કરતાં વધુ હકારાત્મક અસર પડશે. PAFs દ્વારા જમીન/મિલકતના નુકસાનના સંદર્ભમાં થતા સામાજિક ખર્ચની ભરપાઈ મોટે ભાગે સક્રિય પગલાં લઈને થઈ શકે છે. સૂચિત જમીન સંપાદનના પરિણામે આજીવિકાનું કોઈ નુકસાન નથી. આ પ્રોજેક્ટ સ્થાનિક વસ્તી માટે પ્રવાસન અને તકો વધારશે .

પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારો, જનપ્રતિનિધિઓ, સરકારી વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક લોકો સહિત હિતધારકો સાથેની ચર્ચાઓ અને વાર્તાલાપ સૂચવે છે કે આ પ્રોજેક્ટ શહેરની સુંદરતા અને પ્રવાસનના વિકાસ અને વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.

SIA ટીમ એ જણાવવા માટે સર્વસંમત છે કે PAF સંપાદન માટે જમીન ઓફર કરવા માટે તૈયાર છે અને તે RFCTLARR એક્ટ 2013 ની જોગવાઈઓ અનુસાર થવી જોઈએ. સરકારને પર્યાવરણીય અને સામાજિક બાબતોને સંતુલિત કરવા સૂચન કરવામાં આવ્યું છે અને તેના અમલીકરણ દ્વારા લાભો સૂચિત શમન પગલાં. એવી ભલામણ કરવામાં આવે છે કે નિવારક પગલાંની કિંમત ઘટાડવા અને તે જ સમયે પ્રોજેક્ટની નકારાત્મક અસર ઘટાડવા માટે પ્રથમ વિચારણા કરવામાં આવે.

પ્રકરણ-1 વિગતવાર પ્રોજેક્ટ વર્ણન

1.1 પ્રોજેક્ટ વિશે

સૂચિત જમીન સંપાદન પ્રોજેક્ટ નાની દમણ કિલ્લાની આસપાસના વિકાસ કાર્ય અને વ્યુટીફિકેશન માટે છે. આ પ્રોજેક્ટનો હેતુ નાની દમણ કિલ્લાની નજીકમાં 1151 ચોરસ મીટરનો વિસ્તાર મેળવવાનો છે. જમીન સંપાદનનો હેતુ પાથવે બનાવવા અને શહેરના શ્રેષ્ઠ પ્રવાસી આકર્ષણોમાંના એક તરીકે જગ્યા વિકસાવવાનો છે.

1.2 પ્રોજેક્ટ પૃષ્ઠભૂમિ

દમણમાં પ્રવાસન વિકાસ યોજનાઓને બે મુખ્ય વિકાસ હેઠળ વર્ગીકૃત કરવામાં આવી છે. હેરિટેજ ડેવલપમેન્ટ પ્લાન અને વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્લાન. હેરિટેજ અને વોટર ફ્રન્ટ ટુરિઝમ પણ દમણ પ્રદેશની અનન્ય વેચાણ વિશેષતા તરીકે પ્રસ્તાવિત છે.

હેરિટેજ ડેવલપમેન્ટ પ્લાનમાં મોતી દમણ કિલ્લો, નાની દમણ કિલ્લો, દમણમાં હેરિટેજ સ્ટ્રક્ચર્સ જેવા કે ચર્ચ, જૂની પોર્ટુગીઝ ઈમારતો વગેરેનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત મુખ્ય પ્રવાસી ઉત્પાદનો પૈકી એક મોતી દમણ કિલ્લો વિસ્તાર અને આસપાસના પોર્ટુગીઝ દ્વારા હેરિટેજ વોક છે. વસાહતો, જેને હેરિટેજ ભોજન, સાંસ્કૃતિક શો વગેરે જેવા ઉત્પાદનો દ્વારા વધુ ભારપૂર્વક આપવામાં આવશે.

1.3 પ્રોજેક્ટની આવશ્યકતા અને હેતુ


દમણ અને દીવ માટે વિકાસ પરિપ્રેક્ષ્ય યોજના મુજબ સૂચિત જમીન સંપાદન જરૂરી હોવાનું જણાયું છે. ભૂતકાળના પ્રવાસીઓના આગમનના આધારે, તેથી સૂચિત પ્રોજેક્ટ પ્રદેશ માટે આયોજિત એકંદર વિકાસ માટે મહત્વ ધરાવે છે, વાર્ષિક પ્રવાસી ટ્રાફિક વાર્ષિક 8% ના CAGRથી વધીને વર્ષ 2022 સુધીમાં લગભગ 520,000 થવાનો અંદાજ છે. જોડિયા શહેર દમણની પ્રવાસન ક્ષમતાને સાકાર કરવા માટે પ્રવાસન સ્થળોનું વ્યુટીફિકેશન અને વિકાસ જરૂરી છે.

1.4 પ્રોજેક્ટ સ્થાન

પ્રોજેક્ટનું સ્થાન ફિગમાં બતાવવામાં આવ્યું છે. 2. સૂચિત પ્રોજેક્ટ માટે સંપાદિત કરવાના વિસ્તારની સીમાઓ નાની દમણ કિલ્લાની આજુબાજુમાં છે જે નીચે આપેલ છે:


- કિલ્લાના પાછળના પ્રવેશદ્વાર માટે **પૂર્વ -રોડ**
- **પશ્ચિમ** - રહેણાંક મકાનો
- **ઉત્તર** - રહેણાંક મકાનો
- **દક્ષિણ** - નાની દમણનો કિલ્લો

ફિગ 1: પ્રોજેક્ટ સ્થાન



નાની દમણ કિલ્લાની આસપાસ કામના વિકાસ અને બ્યુટિફિકેશન માટે જમીન સંપાદન અંગેનો ડ્રાફ્ટ SIA રિપોર્ટ.

ફિગ 2: પ્રોજેક્ટ સાઇટ



1.5 પ્રોજેક્ટ ખર્ચ

પ્રોજેક્ટની અંદાજિત કિંમત SIA ટીમને ખબર નથી

1.6 પ્રોજેક્ટ વૈકલ્પિક

સૂચિત પ્રોજેક્ટ જાહેર હેતુ માટે સેવા આપે છે. SIA ટીમનું માનવું છે કે પ્રોજેક્ટના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને સૂચિત જમીન સંપાદન સૌથી યોગ્ય છે. નાની દમણ કિલ્લાના પ્રસ્તાવિત વિકાસ કાર્ય અને બ્યુટિફિકેશન માટે કોઈ વૈકલ્પિક જમીન યોગ્ય નથી.

પ્રકરણ 2

ટીમ કમ્પોઝિશન, અભિગમ અને પદ્ધતિ

SR Asia એ ISO 9001:2015 પ્રમાણિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે ભારતમાં મુખ્ય મથક કંપની એક્ટ-2013 ની કલમ 8 હેઠળ નોંધાયેલ છે અને એશિયન પ્રદેશના 12 થી વધુ દેશોમાં તેની હાજરી છે. SR Asia ટકાઉપણું ડોમેનમાં કામ કરે છે અને સરકાર, જાહેર અને ખાનગી ક્ષેત્ર અને બહુપક્ષીય એજન્સીઓ સાથે કામ કરે છે. સંસ્થા પાસે એવા વ્યાવસાયિકો છે કે જેઓ લાયકાત ધરાવતા હોય અને તમામ સ્તરે કાર્યરત વિવિધ શાખાઓમાં નિપુણતા ધરાવતા હોય. ટીમમાં મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ, અર્થશાસ્ત્રીઓ, સામાજિક વિજ્ઞાનીઓ/માનવશાસ્ત્રીઓ વગેરેનો સમાવેશ થાય છે. સંસ્થાને દેશના વિવિધ રાજ્યોમાં સામાજિક અસર મૂલ્યાંકન કરવાનો અનુભવ છે. RFCTLARR-2013 મુજબ SIA અભ્યાસ કરવા માટે SR એશિયાને વિવિધ રાજ્ય સરકારો જેમ કે હિમાચલ પ્રદેશ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, ઝારખંડ વગેરે સાથે પેનલમાં મૂકવામાં આવ્યું છે.

RFCTLARR એક્ટ 2013 ની કલમ 4 માટે જરૂરી છે કે તમામ SIA અભ્યાસો અભ્યાસના ભાગ રૂપે સર્વે/જાહેર પરામર્શ હાથ ધરે. SIA એ સુનિશ્ચિત કરવાનો ધ્યેય રાખે છે કે પ્રોજેક્ટના લાભાર્થીઓ અને સૂચિત પ્રોજેક્ટની આસપાસના સામાન્ય લોકો સહિત સૂચિત પ્રોજેક્ટમાં રસ ધરાવતા તમામ હિતધારકોને ઓળખવામાં આવે અને પ્રોજેક્ટ પ્લાનિંગ, ડિઝાઇન, બાંધકામ, કામગીરી અને ડિકમિશનિંગ તબક્કા દરમિયાન તેમના અભિપ્રાયને ધ્યાનમાં લેવામાં આવે. નિયમોની જરૂરિયાતોના પાલનમાં, SIA ટીમે ઓક્ટોબર 2023 દરમિયાન આકારણી હાથ ધરી હતી અને PAFs, સ્થાનિક સ્વ-સરકારી નેતાઓ અને વર્તમાન પ્રોજેક્ટના અન્ય હિતધારકો સાથે વાતચીત કરી હતી. આ પ્રકરણ SIA હાથ ધરવા માટે અપનાવવામાં આવેલ અભિગમ અને પદ્ધતિને સમજાવે છે અને SIA એકમ અને અભ્યાસની પ્રવૃત્તિ શેડ્યૂલની ઝાંખી આપે છે.

2.1 ઉદ્દેશ્યો અને અભ્યાસનો અવકાશ

SIA અભ્યાસ નીચેના ઉદ્દેશ્યો સાથે હાથ ધરવામાં આવ્યો હતો:

- પ્રોજેક્ટ માટે સૂચિત જમીન સંપાદન જાહેર હેતુને પૂર્ણ કરશે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા;
- અસરગ્રસ્ત પરિવારોની સંખ્યા, પરિવારોની વાસ્તવિક હોલ્ડિંગના આધારે જમીનની અસ્કયામતોનું પ્રમાણ અને જમીન સંપાદનને કારણે ભૌતિક અથવા આર્થિક રીતે વિસ્થાપિત થવાની સંભાવના ધરાવતા પરિવારોની સંખ્યાનો અંદાજ કાઢવો;
- જમીનો, મકાનોની વસાહતો અને અન્ય સામાન્ય મિલકતોને અસર થવાની સંભાવનાને ઓળખવા;
- સંપાદન માટે પ્રસ્તાવિત જમીનની હદ ઓછામાં ઓછી જરૂરી છે કે કેમ તે તપાસવા માટે;
- હેતુ માટે વૈકલ્પિક સાઇટ ધ્યાનમાં લેવામાં આવી છે કે કેમ તે શોધવા માટે;

- મિલકત, સામાન્ય મિલકત સંસાધનો (સીપીઆર), સામાજિક-આર્થિક માળખાકીય સુવિધાઓ વગેરેના નુકસાનને કારણે પ્રત્યક્ષ અને આડકતરી રીતે અસરગ્રસ્ત બંને પરિવારોને આવરી લઈને પ્રોજેક્ટની સામાજિક અસરોનો અભ્યાસ કરવો અને આ ખર્ચના એકંદર ખર્ચ પરની અસર . પ્રોજેક્ટના ફાયદાઓની સરખામણીમાં પ્રોજેક્ટ;
- સામાજિક અસર વ્યવસ્થાપન યોજના અથવા શમન યોજના (SIMP) દ્વારા યોગ્ય નીતિઓ અને કાર્યક્રમોની રચના કરીને ઉપચારાત્મક હસ્તક્ષેપના પગલાં સૂચવવા .

2.2 ટીમ કમ્પોઝિશન

પરસુરે (પ્રોજેક્ટ કોઓર્ડિનેટર) અને સ્થાનિક ક્ષેત્ર તપાસકર્તાઓ વગેરેની આગેવાની હેઠળ એક ટીમની રચના કરી હતી , જેનું નિર્દેશન શ્રી બિરેન્દ્ર રાતુરી દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમના સભ્યો સામાજિક કાર્ય/વિજ્ઞાનમાં અનુસ્નાતક છે અને સામાજિક ઘટનાઓની તપાસ કરવા, ઇન્ટરવ્યુ અને પ્રશ્નાવલિ સર્વેક્ષણો હાથ ધરવા, જૂથ ચર્ચાઓ કરવા અને પૂછપરછના વિષય પર માહિતી મેળવવા માટે PRA તકનીકોમાં સારી રીતે વાકેફ છે. ટીમના તમામ સભ્યોને SIA ચલાવવાનો અગાઉનો અનુભવ છે.

2.3 અભિગમ અને પદ્ધતિ

RFCTLARR એક્ટ 2013 ને ધ્યાનમાં રાખીને, PAFs, PAPs અને પરોક્ષ રીતે અસરગ્રસ્ત પરિવારો અને લોકોના અધિકારોને યોગ્ય રીતે ઓળખવા માટે તમામ પહેલ કરવામાં આવી છે અને પ્રોજેક્ટ વિશે વિગતવાર ચર્ચા કરવા માટે. પ્રોજેક્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પરિવારો માટે જે લાભ લાવશે અને RFCTLARR અધિનિયમ 2013 PAPsને જમીન સંપાદનની વાજબી અને પારદર્શક રીતે વળતર આપવાના તેમના અધિકારો માટે વાજબી રીતે વળતર આપવાની તકો લાવશે.

ટીમે કલેક્ટર કચેરી, દમણ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનની શોધ કરી છે કે સામાજિક અસર મૂલ્યાંકન અભ્યાસ પહેલા અસરગ્રસ્ત વસ્તી સારી રીતે માહિતગાર છે. પ્રોજેક્ટ ટીમે લોકોના મંતવ્યો, મંતવ્યો, પ્રતિસાદ, વિવિધ માધ્યમો અને મિકેનિઝમ્સ જેવા કે જનપ્રતિનિધિઓને મળવા, PAPs, એકથી એક ચર્ચા, PAPની સંપૂર્ણ વિગતોની ચકાસણી લાવવા માટેની તકનો વધુ ઉપયોગ કર્યો છે.


વધુમાં કોમ્યુનિકેશન ગેપ ઘટાડવા માટે સ્થાનિક રીતે અને એસઆર એશિયાના નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષિત ટીમનો ઉપયોગ ડેટા એકત્રિત કરવા, સમુદાયોને સંક્ષિપ્ત કરવા અને જાહેર સભાઓ, વ્યક્તિગત મુલાકાતો, કેન્દ્રિત જૂથ ચર્ચાઓ વગેરેનું આયોજન કરીને મહત્તમ ભાગીદારી લાવવા માટે કરવામાં આવ્યો હતો. મહત્તમ પારદર્શિતા અને અસરના ન્યૂનતમ મોડ્યુલેશન માટે અધિનિયમના મૂળભૂત તત્વોને પ્રતિબિંબિત કરવા માટે PAPs પ્રકાશિત કરવામાં આવ્યા છે.

માટે જમીન સંપાદનની સામાજિક અસરનો અભ્યાસ કરવાનો અભિગમ જરૂરિયાતોને આવરી લેવા માટે આયોજન કરવામાં આવ્યો હતો. તેમાં ગુણાત્મક અને જથ્થાત્મક સંશોધન પદ્ધતિઓ જેમ કે ડેસ્ક સંશોધન, પ્રોજેક્ટ અસરગ્રસ્ત વસ્તી અને જાહેર પ્રતિનિધિઓ સાથે જાહેર પરામર્શ, ફોકસ જૂથ ચર્ચાઓ અને સર્વેક્ષણ પ્રશ્નાવલિનો સમાવેશ થાય છે.

2.3.1 પદ્ધતિઓ અને સાધનોનો ઉપયોગ

SIA અભ્યાસ માટે ગુણાત્મક અને જથ્થાત્મક પદ્ધતિઓના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિઓએ નગરની રૂપરેખા, PAFsની સામાજિક-આર્થિક રૂપરેખા, આ પ્રોજેક્ટની સંભવિત અસર, અને પ્રોજેક્ટની નકારાત્મક અસરોને ઘટાડવા માટે અપનાવી શકાય તેવા ઘટાડાના પગલાંને સમજવામાં મદદ કરી. SIA અભ્યાસ માટે નીચેની પદ્ધતિઓ અને સાધનો અપનાવવામાં આવ્યા હતા:

- ડેસ્ક સમીક્ષા
- સાઇટ મુલાકાતો
- ZOHO સર્વે એપનો ઉપયોગ કરીને પ્રશ્નાવલી
- હિતધારકોની પરામર્શ
- જાહેર પરામર્શ / ફોકસ જૂથ ચર્ચા
- ટાઇમ-સ્ટેમ્પ કેમેરા એપનો ઉપયોગ કરીને ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી.



2.3.2 ડેસ્ક સમીક્ષા

અભ્યાસ દરમિયાન RFCTLARR એક્ટ 2013, મહેસૂલ અને જમીન સુધારણા વિભાગના ઉપલબ્ધ અહેવાલો, પ્રોજેક્ટ-સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડ્સ અને નકશા, જમીન માલિકોની વિગતો વગેરે સહિત સાહિત્યની સમીક્ષા કરવામાં આવી હતી. PAFsની સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિ, પ્રોજેક્ટની અસરની તીવ્રતા અને પ્રોજેક્ટની નકારાત્મક અસરોને ઘટાડવા માટેના પગલાં લઈ શકાય તે માટે આ

કરવામાં આવ્યું હતું. ડેસ્ક સમીક્ષાએ પ્રાથમિક માહિતી સંગ્રહ માટે સાધનો વિકસાવવામાં પણ મદદ કરી.

2.3.3 સાઇટની મુલાકાત

પ્રોજેક્ટ ટીમે પ્રોજેક્ટની જમીન પરના સંસાધનો અને જમીનના ઉપયોગની પેટર્નનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવા માટે જે જમીન સંપાદિત કરવાની હતી તેની ભૌતિક રીતે મુલાકાત લીધી. સાઇટની મુલાકાતોએ જમીન પરની સંભવિત અસરનું મૂલ્યાંકન કરવામાં પણ મદદ કરી.

2.3.4 પ્રશ્નાવલી સર્વે અને FGDs

અસરગ્રસ્ત પરિવારોની સામાજિક-આર્થિક રૂપરેખા અને પ્રોજેક્ટની અસરોની તમામ શ્રેણીઓને સમજવા માટે, એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી. ઓનલાઇન પ્રશ્નાવલી (ઝોહો સર્વેક્ષણમાંથી તૈયાર કરવામાં આવેલ)માં અધિનિયમની જોગવાઈ મુજબ જરૂરી માહિતી મેળવતા બંને ખુલ્લા અને બંધ-સમાપ્ત પ્રશ્નોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં **પરિશિષ્ટ 1** તરીકે પ્રશ્નાવલીનો નમૂનો જોડવામાં આવ્યો છે. ઉપરાંત, સ્થળ મુલાકાત દરમિયાન PAFs સાથે કેન્દ્રિત જૂથ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. SIMP (સોશિયલ ઇમ્પેક્ટ મેનેજમેન્ટ પ્લાન) માટે સર્વગ્રાહી અભિગમ આપવા માટે આનું વધુ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

2.3.5 હિતધારકોની પરામર્શ

પરિસ્થિતિની ઊંડી સમજ મેળવવા માટે, પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારો અને કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે હિસ્સેદારોની પરામર્શ હાથ ધરવામાં આવી હતી, વગેરે. કલેક્ટર કચેરી દ્વારા પ્રોજેક્ટ સાઇટના નકશા અને અન્ય સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ તે જમીન સંપાદન કરવાની આવશ્યકતા અને આ પ્રોજેક્ટથી દમણના વિકાસમાં કેવા ફાયદા થશે અને તેની હિસ્સેદારો પર શું અસર થશે તે સમજવા માટે કરવામાં આવી હતી. અહેવાલના નીચેના પ્રકરણમાં યોજાયેલી ચર્ચાઓની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જમીનની પૃષ્ઠભૂમિ અને પ્રોજેક્ટની સંભવિત અસર પર PAFs સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાએ નાની દમણ કિલ્લાની આસપાસ વર્ક ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન માટે સંપાદિત કરવામાં આવનાર તેમની જમીન અંગે PAFsના અભિપ્રાયને સમજવામાં મદદ કરી. પરામર્શ દરમિયાન, PAF એ જમીન સંપાદન સંબંધિત તેમની ચિંતાઓ અને શરતો શેર કરી.

પ્રશ્નાવલિ સર્વેક્ષણો અને પરામર્શમાંથી મેળવેલ ડેટાનું વિશ્લેષણ અસરગ્રસ્ત વસ્તી પર સંબંધિત આધારરેખા માહિતીનો સારાંશ આપવા માટે કરવામાં આવ્યું હતું; પ્રોજેક્ટ અસરની તમામ શ્રેણીઓ જેમાં લોકો અને સામાન્ય પર્યાવરણ પર ભૌતિક અને/અથવા આર્થિક પ્રકૃતિની સીધી અને પરોક્ષ અસરનો સમાવેશ થાય છે. પરામર્શ અને સામાજિક-આર્થિક સર્વેક્ષણ દ્વારા પ્રાપ્ત પ્રતિભાવો આ અહેવાલના અનુગામી પ્રકરણોમાં રજૂ કરવામાં આવ્યા છે.

2.4 જાહેર સુનાવણી

RFCTLARR અધિનિયમ 2013 ની કલમ 5 એ પરિકલ્પના કરે છે કે જ્યારે પણ SIA અભ્યાસ હાથ ધરવાની જરૂર હોય, ત્યારે સરકાર એ સુનિશ્ચિત કરશે કે અસરગ્રસ્ત પરિવારોના મંતવ્યો સુનિશ્ચિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં જાહેર સુનાવણી યોજવામાં આવે જે SIA રિપોર્ટમાં નોંધવામાં આવે છે અને સમાવિષ્ટ છે. . RFCTLARR એક્ટ 2013 એ જાહેર સુનાવણી હાથ ધરવા માટે વિગતવાર પ્રક્રિયાઓ નિર્ધારિત કરી છે. ઉપરોક્તને અનુસરીને, એસઆર એશિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ જાહેર સુનાવણીનું આયોજન કરશે.

2.5 SIA અભ્યાસની સૂચિ

જમીન સંપાદન વિભાગ (નાયબ કલેક્ટર અધિકારી- દમણ) તરફથી SIA કાર્યની પુષ્ટિ મળ્યા બાદ, પ્રોજેક્ટ પ્રવૃત્તિઓનું વિગતવાર આયોજન કરવામાં આવ્યું હતું. સંદર્ભની દ્રષ્ટિએ (TOR) પ્રસ્તાવિત કાર્ય મુજબ, કાર્ય શેડ્યુલ વિકસાવવામાં આવ્યું હતું.

S. નં.	પ્રવૃત્તિ	અઠવાડિયા							
		WK 1	WK 2	WK 3	WK 4	WK 5	WK 5	WK 7	WK 8
1	ટીમ રચના								
2	ડેસ્ક સંશોધન								
3	પ્રોજેક્ટ પ્લાનિંગ								
4	ફિલ્ડ ટીમની તાલીમ								
5	હિતધારકો સાથે બેઠક								

6	એક્ઝેક્યુશન: સાઇટની મુલાકાત								
7	પ્રશ્નાવલી સર્વેક્ષણ								
8	માહિતી વિશ્લેષણ								
9	અહેવાલ લેખન								
10	ડ્રાફ્ટ રિપોર્ટની રજૂઆત								
11	જાહેર સુનાવણી								
12	અંતિમ અહેવાલની રજૂઆત								

2.6 મોનીટરીંગ અને ગુણવત્તા ખાતરી

- પ્રોજેક્ટ ટીમ લીડર દ્વારા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ટીમના વિવિધ સભ્યોની ભૂમિકાઓ અને જવાબદારીઓ પ્રોજેક્ટની શરૂઆત પહેલા પ્રોજેક્ટ લીડર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.
- સમયસર પ્રોજેક્ટ પૂરો કરવા માટે, વિવિધ પ્રવૃત્તિઓ અને સીમાયિત્તો ઓળખીને કામનું વિભાજન માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.
- દરેક પ્રવૃત્તિની શરૂઆત અને સમાપ્તિ તારીખ અને સીમાયિત્તો વ્યાખ્યાયિત કરવા પ્રવૃત્તિઓનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આયોજિત લક્ષ્ય તારીખ સામે સ્થિતિ તપાસવા માટે આ દસ્તાવેજની નિયમિત સમયાંતરે સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રકરણ- 3 જમીન આકારણી

3.1 પ્રોજેક્ટ માટે જરૂરી જમીન

કુલ 1151 ચોરસ મીટર . દમણમાં નાની દમણ કિલ્લાની આસપાસના કામના વિકાસ અને વ્યુટિફિકેશન માટે જમીન સંપાદિત કરવાની છે. સૂચિત પ્રોજેક્ટ દમણમાં પર્યટનના સર્વાંગી વિકાસનો એક ભાગ છે અને સ્થાનિક લોકો માટે આજીવિકા અને અન્ય વ્યાપારી તકોના વિકાસની તકો ઊભી કરે છે.

3.2 જમીન અને માટીનો પ્રકાર

જે જમીન સંપાદિત કરવાની છે તે રહેણાંક અને ખુલ્લી જમીન છે જેમાં લગભગ 10 વૃક્ષો અને 30 છોડ છે. આ વિસ્તારની જમીન ભૂરા રંગની છે .

3.3 જમીન ઉપયોગ પેટર્ન

ફિલ્ડ વિઝિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે સંપાદિત કરવાની જમીનનો ઉપયોગ રહેણાંક હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં, કોઈ કોમન પ્રોપર્ટી રિસોર્સ (CPR) નથી. PAF આનુવંશિકતા દ્વારા જમીનની માલિકી ધરાવે છે અને ઘણા લાંબા સમયથી રહે છે. SIA ટીમ દ્વારા સ્થળ મુલાકાત અને PAPs સાથેની ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન જમીનના ઉપયોગની પેટર્ન અને માલિકીમાં કોઈ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા નથી.

3.4 જમીન આકારણી વિગતો

પ્રોજેક્ટ ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને જમીન સંપાદન કચેરી દ્વારા પૂરી પાડવામાં આવેલ વિગતોની ચકાસણી કરી હતી. વિગતો નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે:

કોષ્ટક 2: જમીન આકારણી વિગતો

વર્ણન	જમીનની આકારણી અને મિલકતોની ચકાસણી
જમીનની માલિકી (સંપાદિત કરવાની સૂચિત જમીન)	LA નોટિફિકેશન મુજબ, આ જમીન PAF ની છે.

સૂચિત જમીનની કામગીરીના વિસ્તારની જમીનના ઉપયોગની વિગતો	પીએફએ મુજબ, ડીસી દમણ દ્વારા જમીન સંપાદન હેઠળ માંગવામાં આવેલી ઉક્ત જમીન પર સરકાર દ્વારા પ્રોજેક્ટને પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે.
જમીન સંપાદન માટેની આવશ્યકતા નક્કી કરવી	નાની દમણ કિલ્લાના વ્યુટિફિકેશન અને પ્રવાસન સ્થળના સર્વાંગી વિકાસ માટે આ પ્રોજેક્ટ જરૂરી છે. કિલ્લાની આસપાસના માર્ગો વિકસાવવા માટે સૂચિત જમીન સંપાદિત કરવી જરૂરી છે
સામાન્ય મિલકત સંસાધન (CPR) જે સૂચિત જમીન સંપાદનને કારણે ખલેલ પહોંચાડી શકે છે	શૂન્ય

3.5 જમીનની માલિકી

જે જમીન સંપાદિત કરવાની છે તે 7 પરિવારોની ખાનગી માલિકીની છે . જમીનની માલિકી અંગે, PAF એ જ મિલકત પર રહે છે . ક્ષેત્રીય સર્વેક્ષણ દરમિયાન, અસરની માત્રાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાંથી મેળવેલ ડેટા મુજબ, PAPs આંશિક રીતે સંપાદનથી પ્રભાવિત થાય છે.

3.6 જમીન અને વિસ્તાર ધારક

SIA ટીમે કલેક્ટર કચેરીમાંથી પ્રોજેક્ટ અને અન્ય વિગતો જેવી કે જમીન વગેરેની માહિતી એકત્ર કરી હતી. વધુ વિગતો નીચે આપેલ છે.

કોષ્ટક 3: જમીન વિસ્તાર અને જમીન ધારકની વિગતો

ક્રમ નં	ગામ/શહેરનું નામ	સર્વે નંબર/ PTS/ ચલતા નં	જમીન નો વર્ગ	જમીનની માલિકીમાં રસ ધરાવતી વ્યક્તિનું નામ	મીટરમાં સંપાદિત કરવાનો વિસ્તાર
1	નાની દમણ	47/148-એ	એન.એ	બાનુ ગીવાન	62.00

નાની દમણ કિલ્લાની આસપાસ કામના વિકાસ અને બ્યુટીફિકેશન માટે જમીન સંપાદન અંગેનો ડ્રાફ્ટ SIA રિપોર્ટ.

2	નાની દમણ	47/147	એન.એ	સુકર નારણ	14.00
3	નાની દમણ	47/145	એન.એ	રામીબેન વલ્લભ ટંડેલ ગણેશ વલ્લભ ટંડેલ પરેશ વલ્લભ ટંડેલ અશ્વિન વલ્લભ તબડેલ હિતેન્દ્ર વલ્લભ ટંડેલ	1075.00
				કુલ	1151.00

પ્રકરણ-4

અસરગ્રસ્ત પરિવારનો અંદાજ અને ગણતરી

આ પ્રકરણમાં સીધી અસરગ્રસ્ત જમીનમાલિક અને નાની દમણ કિલ્લાની આસપાસના કામના વિકાસ અને વ્યુટિફિકેશન માટે જમીન સંપાદનની તેમના પરિવારો, મિલકતો, સંસાધનો વગેરે પર થતી અસરનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સૂચિત જમીન એક ખુલ્લો પ્લોટ છે અને ત્યાં થોડા બાંધકામો છે. પ્રસ્તાવિત જમીન કારણ કે પ્રોજેક્ટ તેમના પરિવાર અને સંસાધનો પર તાત્કાલિક અસર કરશે. ઉપર જણાવ્યા મુજબ, 1151 ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની છે તે 3 સર્વે નંબરોમાં ફેલાયેલી છે, જે પ્રોજેક્ટના વિકાસ દ્વારા પ્રભાવિત થશે.

4.1 રહેઠાણ/અસરગ્રસ્ત માળખાઓની સંખ્યા

જે જમીન સંપાદિત કરવાની છે તેનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થાય છે. નીચે આપેલ કોષ્ટક અસરગ્રસ્ત મિલકતના અંદાજનું ટૂંકમાં વર્ણન કરે છે.

કોષ્ટક 4: રહેઠાણ/અસરગ્રસ્ત માળખાની સંખ્યા

S. નં	નુકસાનની શ્રેણી	વર્ણન
1	કુલ જમીન વિસ્તાર	1151 ચોરસ મીટર
2	સ્ટ્રક્ચર્સ	બાઉન્ડ્રી વોલ સાથે પક્કા ઘરનું માળખું મળી આવ્યું છે
3	આજીવિકા	પ્રોજેક્ટના પરિણામે આજીવિકાનું કોઈ નુકસાન થયું નથી
4	સામાન્ય મિલકત સંસાધન	શૂન્ય
5	કોઈપણ અન્ય (સાંસ્કૃતિક વારસો)	શૂન્ય

4.2 સામાન્ય સંપત્તિનું નુકસાન

નાની દમણ કિલ્લાની આસપાસના વિકાસ અને બ્યુટીફિકેશન માટે જમીન સંપાદન કરવાથી સામાન્ય મિલકતને અસર થશે નહીં.

કોષ્ટક 5: સામાન્ય મિલકતનું નુકસાન

એસ નં	ખાસ	કુલ સંખ્યા
1	મંદિર	શૂન્ય
2	મસ્જિદ/ગુરુદ્વારા/ચર્ય	શૂન્ય
3	હેન્ડ પંપ	શૂન્ય
4	ટ્રાન્સફોર્મર	શૂન્ય
5	ઇલેક્ટ્રિક થાંભલા	શૂન્ય
6	જળ સંસ્થાઓ	શૂન્ય
7	સરકારી માળખાં	શૂન્ય
8	શૈક્ષણિક સંસ્થા	શૂન્ય
9	ટ્રેનેજ અને ગટર લાઇન	શૂન્ય

4.3 વ્યક્તિગત સંપત્તિની ખોટ

જમીન, માળખું અને વૃક્ષોના નુકસાનના રૂપમાં વ્યક્તિગત સંપત્તિ પ્રોજેક્ટથી પ્રભાવિત થશે. વિગતો નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે:

કોષ્ટક 6: વ્યક્તિગત સંપત્તિનું નુકસાન

S. નં	ખાસ	કુલ સંખ્યાઓ
1	રહેણાંક મકાનો	2
2	બોરવેલ	1

નાની દમણ કિલ્લાની આસપાસ કામના વિકાસ અને બ્યુટીફિકેશન માટે જમીન સંપાદન અંગેનો ડ્રાફ્ટ SIA રિપોર્ટ.

3	ખેતરના તળાવો	શૂન્ય
4	શેડ	1
5	કમ્પાઉન્ડ દિવાલો	1
6	પાણીની ટાંકી અથવા હેન્ડપંપ	શૂન્ય
7	પાઇપલાઇન	શૂન્ય
8	વ્યાપારી સંસ્થાઓ (દુકાનો વગેરે)	શૂન્ય
9	અન્ય કોઈપણ પ્રવૃત્તિ	1
10	વૃક્ષો/બગીચો/ જરાયત	નાળિયેર, કેરી અને અન્ય વૃક્ષો.
11	ભાડે આપવાના હેતુ માટે કોમર્શિયલ પ્લોટ	શૂન્ય

પ્રકરણ 5 સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક પ્રોફાઇલ

આ પ્રકરણ પ્રોજેક્ટ વિસ્તાર અને પ્રોજેક્ટથી અસરગ્રસ્ત વ્યક્તિઓની સામાજિક-આર્થિક રૂપરેખાનું વર્ણન કરે છે. આ પ્રકરણ ખાસ કરીને વિગતવાર સર્વેક્ષણના આધારે જમીન અને અન્ય સ્થાવર મિલકતો પરની અસરોનું વિશ્લેષણ કરે છે. જમીન પરની અસરના આધારે, દમણ ખાતે નમૂનાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને સર્વેક્ષણના પરિણામોએ PAF ની સામાજિક-આર્થિક સ્થિતિ સ્થાપિત કરી હતી. જો કે, PAF એ સામાજિક અને આર્થિક માહિતી શેર કરવા માટે સંમત થયા નથી કારણ કે કુટુંબની સામાજિક અને આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરવા માટે જરૂરી હતું.

5.1 ડેમોગ્રાફિક પ્રોફાઇલ

વસ્તી વિષયક રીતે, દમણ અને દીવનું UT ઉચ્ચ મધ્યમ-આવક જૂથમાં આવે છે, જે PAFsની સામાજિક-આર્થિક પ્રોફાઇલમાં પણ પ્રતિબિંબિત થાય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, સંઘ પ્રદેશ દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના દમણ જિલ્લાની કુલ વસ્તી નીચે મુજબ છે;

કોષ્ટક 5.1: દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશની વસ્તીની વસ્તી વિષયક વિગતો

શ્રેણી/તહેસીલો	વિગતો	ટકાવારી (%)
કુલ વસ્તી	1,91,173 છે	100%
નર	1,24,659 છે	61.78%
સ્ત્રીઓ	66,514 પર રાખવામાં આવી છે	38.22%
કુલ સાક્ષરતા	150, 348	88.07 %
પુરુષ	104, 316	91.61 %
સ્ત્રી	46, 032	80.98 %
ઘનતા/ Km2	2, 655 વ્યક્તિઓ	
નજીકના રેલ્વે સ્ટેશનથી અંતર	30 કિમી (વાપી)	

નજીકના એરપોર્ટથી અંતર	લગભગ 130 કિમી (સુરત, ગુજરાત)
સામાન્ય ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે	નાળિયેર, ઘઉં, ચોખા, મગફળી, આમલી વગેરે.
સિંચાઈ પદ્ધતિ	હેન્ડપંપ એન્જિન, નહેર અને ટ્યુબવેલ વગેરે.
PAF ની સરેરાશ માસિક આવક	રૂ. 24, 500 છે


5.2 સામાજિક-આર્થિક પ્રોફાઇલ

કુટુંબની વિગતો, સામાજિક વર્ગીકરણ, શિક્ષણ અને વ્યવસાય, કૌટુંબિક આવક વગેરે પર વસ્તી વિષયક માહિતી સહિત PAF ની વિગતવાર સામાજિક-આર્થિક રૂપરેખાઓ નીચે મુજબ છે.

a) વય જૂથ

તારણો દર્શાવે છે કે લગભગ 60% ઉત્તરદાતાઓ 41-50 વર્ષની વય જૂથ વચ્ચેના છે. કુલમાંથી, 20% ઉત્તરદાતાઓ 51-60 વર્ષની વય જૂથમાં આવેલા છે જ્યારે બાકીના 20% ઉત્તરદાતાઓ 31-40 વર્ષની વય જૂથમાં આવેલા છે.


આલેખ 5.1: જમીનના માલિકોનું વય મુજબનું વિતરણ



b) જાતિ

કુલ ઉત્તરદાતાઓમાંથી 60% પુરુષ અને 40% ઉત્તરદાતાઓ સ્ત્રી હતા

આલેખ 5.2: જમીનના માલિકોનું લિંગ મુજબનું વિતરણ




c) સામાજિક જૂથ

તમામ PAF અન્ય પછાત વર્ગ (OBC) ના છે.

આલેખ 5.3: PAF નું સામાજિક જૂથ મુજબનું વિતરણ


નાની દમણ કિલ્લાની આસપાસ કામના વિકાસ અને વ્યુટીફિકેશન માટે જમીન સંપાદન અંગેનો ડ્રાફ્ટ SIA રિપોર્ટ.



a) વૈવાહિક સ્થિતિ

નીચેનું કોષ્ટક દર્શાવે છે કે 60% ઉત્તરદાતાઓ પરિણીત છે અને તેમને બાળકો છે જ્યારે 20% ઉત્તરદાતાઓ પરણિત નથી.


આલેખ 5.4: જમીનના માલિકની વૈવાહિક સ્થિતિ



e) ધાર્મિક જૂથ

તમામ PAF હિંદુ ધર્મના છે.


આલેખ 5.5: PAFsનું ધાર્મિક જૂથ



f) કૌટુંબિક પ્રકાર અને કદ

લગભગ 80% પરિવારો પ્રકૃતિમાં પરમાણુ હોય છે (કુટુંબમાં 2-4 સભ્યો હોય છે) અને બાકીના 20% પરિવારો મધ્યમ કદના પરમાણુ પરિવારો (5-7 કુટુંબના સભ્યો ધરાવતા) હોય છે.


ગ્રાફ 5.6: કુટુંબનો પ્રકાર અને કદ



g) શૈક્ષણિક સ્થિતિ

PAP સારી રીતે શિક્ષિત છે. લગભગ 40% ઉત્તરદાતાઓ સ્નાતક અને અનુસ્નાતક છે. કોઈ PAP અભણ નથી.

આલેખ 5.7: જમીનના માલિકોની શૈક્ષણિક સ્થિતિ




h) કુટુંબનો મુખ્ય વ્યવસાય

PAP નાના વેપાર અને સરકારી સેવા સાથે સંકળાયેલા છે

i) કુટુંબની માસિક આવક

સર્વેક્ષણ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે લગભગ 40% પરિવારોની માસિક આવક રૂ. 20000 થી 50000 છે અને તેમાંથી અન્ય 40% ની આવક 50000 થી 100000 સુધી છે. આ દર્શાવે છે કે મોટા ભાગના PAF ઉચ્ચ આવક જૂથમાં આવે છે.


ગ્રાફ 5.8: PAFsની માસિક કૌટુંબિક આવક



j) ઇયરિંગ સભ્યોની સંખ્યા

મોટા ભાગના પરિવારોમાં કુટુંબનો એક જ કમાઉ સભ્ય હોય છે. PAP ની કમાણી કૌટુંબિક વ્યવસાય અથવા સરકારી સેવા અને તેમની પાસેની જમીન અને શેડના ભાડામાંથી આવે છે.


આલેખ 5.9: PAF ના કમાતા સભ્યોની સંખ્યા



k) ઘરની રચનાનો પ્રકાર

પરિવારના લગભગ 80% સભ્યો પાસે પાકાં સાદા કોંક્રિટ મકાનો છે જ્યારે 20% PAF પાસે એક માળની ઇમારતો છે.

ગ્રાફ 5.9: PAF ના ઘરની રચનાનો પ્રકાર



5.3 સ્ટેકહોલ્ડર પરામર્શ

પ્રોજેક્ટ ટીમે ક્ષેત્રની મુલાકાત દરમિયાન પ્રોજેક્ટના હિતધારકોને ઓળખ્યા અને તેમની સલાહ લીધી. આ પરામર્શ પ્રોજેક્ટને વધુ સારી રીતે સમજવા અને વિવિધ દ્રષ્ટિકોણ એકત્ર કરવા માટે હાથ ધરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકો સૂચિત પ્રોજેક્ટ પર મિશ્ર અભિપ્રાય ધરાવે છે. તેમાંથી કેટલાકનો અભિપ્રાય છે કે નાની દમણના વિકાસ અને સુંદરતા પ્રવાસીઓને આકર્ષશે અને લોકો માટે આવકની તકો વધારવામાં મદદ કરશે. જો કે કેટલાક હિસ્સેદારોએ જણાવ્યું હતું કે દમણના અન્ય પર્યટન સ્થળોની સરખામણીમાં કિલ્લા પરની સંખ્યા ઘણી ઓછી છે અને સૂચિત પ્રોજેક્ટ સાથે તેમાં નોંધપાત્ર સુધારો થઈ શકશે નહીં. આથી નાની દમણના કિલ્લાને વ્યાપક પુનઃસંગ્રહ અને વિકાસની જરૂર છે.

પ્રકરણ 6 પબ્લિક કન્સલ્ટેશન

ક્ષેત્રની મુલાકાત દરમિયાન પ્રોજેક્ટ સાઇટ પર જાહેર પરામર્શ બેઠક યોજવામાં આવી હતી. જાહેર પરામર્શના ભાગરૂપે PAPs, PAFs અને અન્ય હિસ્સેદારોના મંતવ્યો નોંધવામાં આવ્યા હતા. પરામર્શ પ્રક્રિયા દરમિયાન હિતધારકો સાથે ચર્ચા અને વિચારણા કરવામાં આવેલ મુદ્દાઓની પણ નોંધ લેવામાં આવી હતી. જાહેર પરામર્શ દરમિયાન ઓળખવામાં આવેલ મુખ્ય મુદ્દાઓ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે.

કોષ્ટક 6.1: મુખ્ય મુદ્દાઓ અને ચિંતા

ક્રમ નં	સર્વે નં.	નામ	મુદ્દો ઉઠાવ્યો	હિસ્સેદારોની ટિપ્પણી
1	47/147	ભાવના સુકર	<p>અમે અમારી જમીન આપવા તૈયાર છીએ પરંતુ જમીન અને મકાનના માળખાનું વળતર કેટલું થશે?</p> <p>સરકાર કેવા પ્રકારના પ્રોત્સાહનો આપે છે?</p> <p>જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયાને સમાપ્ત કરવામાં કેટલો સમય લાગે છે?</p> <p>અમને આ સર્વે નંબર હેઠળ આખો પ્લોટ આપવામાં આનંદ થાય છે. જો સરકાર આંશિક રીતે હસ્તગત કરી રહી છે તો તેના વધુ ઉપયોગ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.</p>	<p>સત્તાધિકારી જાહેર સુનાવણી દરમિયાન સૂચિત જમીન સામેના મુદ્દા અને ચિંતાઓની ચકાસણી કરશે અને તેનું નિરાકરણ કરશે</p>
2	47/145	અશ્વિન વલ્લભ પટેલ	<p>અમે જિલ્લા વહીવટીતંત્રને સૂચિત જમીન સંપાદનની સીમા પર પુનર્વિચાર કરવા વિનંતી કરીએ છીએ.</p>	<p>સત્તાધિકારી જાહેર સુનાવણી દરમિયાન સૂચિત જમીન સામેના મુદ્દા અને ચિંતાઓની ચકાસણી કરશે અને તેનું નિરાકરણ કરશે</p>

			અમે વળતરની રકમ વિશે જાણતા નથી. સરકારે સંપાદિત કરવાની જમીન માટે યોગ્ય વળતર આપવું જોઈએ	
--	--	--	--	--

પ્રકરણ 7

સામાજિક અસર અને સામાજિક અસર વ્યવસ્થાપન યોજના

આ સામાજિક અસર વ્યવસ્થાપન યોજના (SIMP) RFCTLARR અનુસાર આ પ્રોજેક્ટની નકારાત્મક સામાજિક અસરોને ઘટાડવા માટે તૈયાર કરવામાં આવી છે. SIMP માં પ્રતિકૂળ સામાજિક અસરોને દૂર કરવા અથવા તેને સ્વીકાર્ય સ્તરે ઘટાડવા માટે પ્રોજેક્ટની ડિઝાઇન, વિકાસ અને ઓપરેશનલ તબક્કાઓ દરમિયાન લેવામાં આવતા શમન, દેખરેખ અને સંસ્થાકીય પગલાંનો સમાવેશ થાય છે. SIMP નો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિવિધ પ્રતિકૂળ અસરોને ઓછી કરવામાં આવે અને સકારાત્મક અસરોમાં વધારો થાય. SIMP નો અમલ પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓ દરમિયાન કરવામાં આવશે જેમ કે. પૂર્વ-વિકાસનો તબક્કો, વિકાસનો તબક્કો અને કાર્યકારી તબક્કો.

જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન અધિનિયમ 2013 માં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકારની કલમ 4 ના પાલનમાં, વર્તમાન સામાજિક અસર આકારણી જમીન સંપાદનની સંભવિત સામાજિક-આર્થિક હકારાત્મક અને નકારાત્મક અસરોને ઓળખવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી હતી. અને સકારાત્મક અસરોને વધારવા અને નકારાત્મક અસરોને ઘટાડવા અથવા ટાળવા માટે પ્રાપ્ય શમન પગલાં વિકસાવવા અને તેના દ્વારા નાની દમણના કિલ્લાની આસપાસના વિકાસ કાર્ય અને સુંદરીકરણ માટે જમીન સંપાદનની સહભાગી, જાણકાર અને પારદર્શક પ્રક્રિયાની ખાતરી કરવી.

શમન માટે અભિગમ

એસઆઈએ ટીમે વિવિધ સામાજિક અસરોની ઓળખ અને શમનના પગલાં માટે સંશોધન અભિગમો એટલે કે માત્રાત્મક અને ગુણાત્મક સંયોજનનો ઉપયોગ કર્યો. ગુણાત્મક અને જથ્થાત્મક બંને પદ્ધતિના સંયોજનને અપનાવવાનો હેતુ મૂલ્યાંકનના કોઈપણ મહત્વપૂર્ણ ક્ષેત્રને બાકાત રાખ્યા વિના વધુ વ્યાપક ડેટા અને વધુ સર્વગ્રાહી પરિણામ મેળવવાનો હતો. સૂચિત ઘટાડાના પગલાં વિવિધ શ્રેણીના હિસ્સેદારો, જેમ કે પ્રોજેક્ટ અસરગ્રસ્ત વસ્તી, મહેસૂલ અને જમીન સુધારણા વિભાગના સરકારી અધિકારીઓ સાથેની શ્રેણીબદ્ધ ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચર્ચાઓ દ્વારા પ્રાપ્ત થયા હતા. સામાજિક અસર અંગેની એકત્રિત માહિતીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને શમન યોજના ઘડવા માટે નિષ્ણાતો સાથે આંતરિક અને બાહ્ય રીતે ચર્ચા કરવામાં આવી હતી. આવી ક્રિયાપ્રતિક્રિયાઓની પ્રક્રિયા અસરને ઘટાડવા અને ટાળવા અથવા ઘટાડવા માટે વિવિધ પગલાં ઘડવા પર પરિણમી.

સામાજિક અસર

મીટરની હદ સુધી મર્યાદિત હતો. 7 PAF દ્વારા કબજો મેળવ્યો હતો. બહુપક્ષીય વ્યૂહરચના દ્વારા મેળવેલી માહિતી દર્શાવે છે કે મોટા ભાગના જમીનધારકો નાની દમણ કિલ્લાની આસપાસના વિકાસ કાર્ય અને વ્યુટીફિકેશનથી ખુશ હતા. ઓળખાયેલ વિસ્તારમાં. તે જ સમયે, તેઓએ કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી કે

જે તેમની જમીનના સંપાદનને કારણે સમાજમાં તેમના સામાજિક અને આર્થિક જીવનને અસર/અસર કરી શકે છે. નીચેના સૂચિત પ્રોજેક્ટની મુખ્ય અપેક્ષિત અસરો (બંને હકારાત્મક અને નકારાત્મક) પૂરી પાડે છે જેની ચર્ચા PAFs દ્વારા પ્રોજેક્ટ ટીમ સાથે કરવામાં આવી હતી:

હકારાત્મક અસરો

પ્રતિભાવોએ દર્શાવ્યું હતું કે નાની દમણના કિલ્લા અને આસપાસના વિસ્તારના વિકાસ કાર્ય અને વ્યુટીફિકેશનથી દમણમાં પ્રવાસન ક્ષેત્રની સંભવિત વૃદ્ધિ અને વિકાસને ધ્યાનમાં રાખીને લોકો અને વિસ્તાર પર સકારાત્મક અસર પડશે. કેટલીક મુખ્ય અસરો નીચે ટાંકવામાં આવી છે:

a) જમીનના ભાવમાં વધારો

વિકાસના કામોથી નાની દમણ કિલ્લાની આસપાસની જમીનોની કિંમતમાં વધારો થવાની સંભાવના છે.

b) ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ

આયોજિત પાથવે અને વ્યુટીફિકેશનના કામના નિર્માણથી મનોરંજનના હેતુ માટે જગ્યા પૂરી પાડવાની દ્રષ્ટિએ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે અને નાના વેપારીઓ માટે રોજગારીની તકો અને અવકાશ પણ ઉભો થશે.

c) રોજગારીની તકો

આ અપેક્ષા છે કે વિકાસ દરમિયાન અને તે પછી કુશળ અને અકુશળ લોકો માટે રોજગારની તકો હશે.

નકારાત્મક અસરો

બાંધકામ પ્રવૃત્તિ ઘણા પર્યાવરણીય જોખમો ઉભી કરશે અને બાંધકામ પછી પણ આરોગ્ય અને સ્વચ્છતાની કોઈપણ અસરોને ઘટાડવા માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવાની જરૂર છે.

a) જમીન પર અસર

સંપાદિત કરવાની જમીન રહેણાંક જમીન છે તેથી જમીન પર કોઈ મોટી નકારાત્મક અસર થશે નહીં. જો કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ તબક્કા દરમિયાન કોન્ક્રીટાઇઝેશન વિસ્તારમાં પ્રદૂષણ તરફ દોરી શકે છે.

b) આજીવિકા પર અસર (આવકના સ્ત્રોતની ખોટ)

આ જમીન સંપાદન કરવાથી આવકના સ્ત્રોત પર કોઈ અસર થશે નહીં કારણ કે તે રહેણાંક વિસ્તાર છે.

c) ભૌતિક સંસાધનો પર અસર (સંપત્તિનું નુકસાન)

સંપાદન વ્યક્તિગત સંપત્તિ જેમ કે નાળિયેરનાં વૃક્ષો વગેરેને અસર કરશે.

d) પર્યાવરણ પર અસર

આ વિસ્તારમાં વૃક્ષોનું નુકશાન પણ પર્યાવરણીય વિવિધતાને અસર કરી શકે છે.

કોષ્ટક 7: હકારાત્મક અને નકારાત્મક અસરોનો સારાંશ

અસર	અસરની સ્થિતિ	નકારાત્મક/સકારાત્મક	પ્રત્યક્ષ/પરોક્ષ	અસ્થાયી / કાયમી	મુખ્ય/માહુનોર
PAFs દ્વારા આ સાઇટ પર આયોજિત આવકના સ્ત્રોત અને પ્રોજેક્ટની ખોટ	હા	નકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	મુખ્ય
જમીનના ભાવમાં વધારો	હા	સકારાત્મક/નકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી/કામચલાઉ	મુખ્ય
આજીવિકા ગુમાવવી	ના	નકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	મુખ્ય
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ	હા	હકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	મુખ્ય
પ્રવાસીઓ માટે માર્ગ	હા	હકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	મુખ્ય
રોજગારીની તકો	હા	હકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	મુખ્ય
પ્રવેશમાં સરળતા/ઘટાડો	એન.એ	હકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	મુખ્ય
પ્રોજેક્ટ સાઇટ પર હાજર વૃક્ષોનું નુકશાન	હા	નકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી/કામચલાઉ	ગૌણ
બાંધકામ દરમિયાન અને પછી રોજગારની તકો	હા	હકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	મુખ્ય

નગર, રાજ્ય અને જિલ્લા માટે બ્રાન્ડ મૂલ્ય	હા	હકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	ગૌણ
જમીન પર અસર	હા	નકારાત્મક	પ્રત્યક્ષ	કાયમી	ગૌણ

સામાજિક અસર ઘટાડવાની યોજના

ડેસ્ક સમીક્ષા, ક્ષેત્રીય તપાસ અને નાની દમણ કિલ્લાના વિકાસ કાર્ય અને બ્યુટિફિકેશન માટે સામાજિક અસર મૂલ્યાંકન અભ્યાસ દરમિયાન હાથ ધરવામાં આવેલા પરામર્શના આધારે, નકારાત્મક સામાજિક અસરોને ઘટાડવા માટે સામાજિક અસર શમન યોજના (SIMP) વિકસાવવામાં આવી છે. સામાજિક અસરો, અસ્કયામતોનું નુકસાન અને વૃક્ષોનું નુકસાન એ પ્રોજેક્ટની મુખ્ય નકારાત્મક અસરો હોવાનું જણાયું હતું. જો કે, સંભવિત પરોપકારી ઇરાદાઓ સાથે બધાને ગર્ભિત રીતે સંચાલિત કરી શકાય છે. આ સંદર્ભે, નીચેના શમન પગલાં અપનાવી શકાય છે:

આર્થિક માપદંડ

- જમીનના સંપાદનને કારણે મિલકત અને અસ્કયામતોનું નુકસાન કલમ 26-31 હેઠળ અધિનિયમ દ્વારા ફરજિયાતપણે વળતર આપવું જોઈએ અને જે એક પરિવાર માટે અધિનિયમની પ્રથમ સૂચિમાં સૂચિબદ્ધ છે.

પુનર્વસન પગલાં

- પ્રોજેક્ટ સાઇટ પર આંશિક રીતે રહેણાંક મકાનો અને બાંધકામ સંસ્થાઓ છે. જો કે કોઈ R&R ની ભલામણ કરવામાં આવતી નથી.

અન્ય પગલાં

- પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સ્ટેજ દરમિયાન સીધી અસરગ્રસ્ત વસ્તી (જો કોઈ હોય તો) ની ચિંતાઓને દૂર કરવા માટે પ્રોજેક્ટ સાઇટ પર જાહેર નિવારણ પદ્ધતિની રચના કરવી જોઈએ.
- જમીનમાલિકોને યોગ્ય વળતર આપવામાં આવશે
- બાંધકામ સામગ્રી અને કચરાને પરિવહન દરમિયાન યોગ્ય રીતે આવરી લેવો જોઈએ/નિકાલ કરવો જોઈએ જેથી કરીને અને અન્ય કોઈ જગ્યાએ સ્પિલેજ અને વિખેરાઈ ન જાય.

- d) સાઈટ વર્કસ/ટ્રક/વાહન ડ્રાઈવરો અને અન્ય સ્ટાફ માટે સામાન્ય રીતે અવાજને મર્યાદિત કરવા માટે યોગ્ય સૂચનાઓ અને સંકેતો પૂરા પાડવામાં આવશે જેમ કે હોર્નનો ઉપયોગ, અવાજ ઉત્પન્ન કરવાના સાધનો અને પ્રક્રિયાઓ.
- e) બાંધકામના તબક્કા દરમિયાન સ્થાનિકોને અડચણ અને ખલેલ ન પહોંચે તે માટે તમામ સાવચેતીઓ લેવામાં આવશે.

ટાળવા, ઘટાડવા અને વળતર આપવાનાં પગલાં

પ્રસ્તાવકર્તાએ ખાતરી કરવી જોઈએ કે મુદ્દાઓને સંબોધવા માટે નિવારક પગલાં લેવામાં આવે છે. મહેસૂલ વિભાગ, પંચાયતના પ્રતિનિધિઓ અને પ્રોજેક્ટના વિવિધ તબક્કા દરમિયાન આવી શકે તેવા અણધાર્યા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે એક નિવારણ પ્રણાલી ગોઠવવામાં આવી શકે છે. નકારાત્મક અસરો સામે સકારાત્મકતાની તુલના/વજન કરતાં, તે સહેલાઈથી નિષ્કર્ષ પર આવી શકે છે કે નાની દમણ કિલ્લાની આસપાસના વિકાસ કાર્ય અને બ્યુટીફિકેશન માટે સૌથી યોગ્ય અને યોગ્ય સ્થળ તરીકે ઓળખાયેલ સ્થળને પુનઃપુષ્ટિ કરતા પહેલાનું વજન પાછળનું છે. એવું જોવામાં આવે છે કે જો કે જમીનધારકો ચોક્કસપણે આંશિક જમીન ગુમાવે છે, તેમ છતાં તેમના જીવનની ગુણવત્તાને અસર થવાની સંભાવના છે. SIA ટીમ દ્વારા એ પણ અવલોકન કરવામાં આવ્યું છે કે ઉપર દર્શાવેલ ઘણી બધી નકારાત્મક અસરો ઉપર જણાવેલ યોગ્ય અને અસરકારક શમન પગલાં/વ્યૂહરચના વડે ઘટાડી અથવા ઘટાડી શકાય છે.

પ્રકરણ 8 ખર્ચ અને લાભ વિશ્લેષણ

નાની દમણ કિલ્લાની આસપાસના વિકાસ કાર્ય અને બ્યુટિફિકેશનના પ્રસ્તાવિત પ્રોજેક્ટની સકારાત્મક અને નકારાત્મક અસરોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી, SIA ટીમે તેના ફાયદા સાથે ખર્ચની તુલના કરી. નીચેના વિભાગમાં, લાભો અને સંબંધિત ખર્ચનું વિગતવાર વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટની ચોક્કસ કિંમત ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પરંતુ જોગવાઈઓ અંદાજિત છે અને ચોક્કસ નથી, તેથી ચોક્કસ ખર્ચ-લાભ વિશ્લેષણ હાથ ધરવામાં આવતું નથી.

8.1 જાહેર હેતુનું મૂલ્યાંકન

સૂચિત પ્રોજેક્ટ સામાન્ય લોકોના હિતમાં છે કારણ કે તે પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિક અર્થતંત્રના વિકાસ પર સકારાત્મક અસર કરશે અને દમણના વિસ્તારમાં નાના વેપાર અને આજીવિકાની તકો વધારવાના જાહેર હેતુને પૂર્ણ કરશે. દમણના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા સમગ્ર સમુદાય માટે આ પ્રોજેક્ટ ફળદાયી સાબિત થશે. તે વધુ સ્થાપિત કરી શકાય છે કે ખાનગી જમીન સંપાદન કરીને અને તે રીતે પ્રોજેક્ટની સૂચિત પ્રવૃત્તિઓને પૂર્ણ કરીને જાહેર હેતુ ચોક્કસપણે પૂર્ણ થશે. આથી, પ્રસ્તાવિત જમીન સંપાદનના સામાજિક ખર્ચ અને લાભોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે પ્રોજેક્ટના સ્થાનમાં અથવા સંપાદિત કરવામાં આવનાર જમીનના જથ્થામાં કોઈ ફેરફાર થશે નહીં.

8.2 માળખાં અને તેની તીવ્રતા પરની અસરો

સંપાદિત કરવાની જમીન પર શેડ, ઘરની દિવાલ વગેરે જેવા થોડા બાંધકામો છે.

8.3 વળતરના નિર્ધારકો

RFCTLARR-2013 ની કલમ 26 અને 27 મુજબ, કલેક્ટર જમીનની બજાર કિંમત અને વળતરની રકમનું મૂલ્યાંકન કરવા અને નિર્ધારિત કરવા માટે નીચેના માપદંડો અપનાવશે. ભારતીય સ્ટેમ્પ અધિનિયમ, 1899 માં નિર્દિષ્ટ બજાર મૂલ્ય, વેચાણ ખતની નોંધણી અથવા જ્યાં જમીન આવેલી છે ત્યાં વેચવાના કરાર માટે, નજીકના ગામ અથવા નજીકના વિસ્તારમાં આવેલી સમાન પ્રકારની જમીનની સરેરાશ વેચાણ કિંમત. તેમના જણાવ્યા મુજબ, આવા દરો તે જ વિસ્તારમાં અન્ય બિલ્ડરો/ખરીદનારાઓ દ્વારા ચૂકવવામાં આવ્યા છે. RFCTLARR-2013 એક્ટની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને વળતર આપવું જોઈએ.

8.4 એન્ટાઈટમેન્ટ મેટ્રિક્સ

PAFs નીચેના પ્રકારના વળતર અને સહાય પેકેજો માટે હકદાર હશે:

- જમીન, પાક/વૃક્ષોના નુકસાન માટે તેમની બદલીના ખર્ચે વળતર;
- જો કોઈ હોય તો માળખા માટે વળતર અને અન્ય સ્થાવર અસ્કયામતો તેમની બદલીના ખર્ચે;
- વ્યવસાય/વેતન આવક અને આવક પુનઃસ્થાપન સહાયની ખોટના બદલામાં સહાય;
- સ્થળાંતર માટે સહાય અને સ્થળાંતરની જોગવાઈ (જો જરૂરી હોય તો), અને
- સમુદાય સંસાધનો/સુવિધાઓનું પુનઃનિર્માણ અને/અથવા પુનઃસંગ્રહ

RFCTLARR-2016 ની કલમ 26 અને 27 મુજબ, કલેક્ટર જમીનની બજાર કિંમત અને વળતરની રકમનું મૂલ્યાંકન કરવા અને નિર્ધારિત કરવા માટે નીચેના માપદંડો અપનાવશે. ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ, 1899 માં નિર્દિષ્ટ બજાર મૂલ્ય, વેચાણ ડીડની નોંધણી માટે અથવા જ્યાં જમીન આવેલી છે ત્યાં વેચવાના કરાર માટે.

- નજીકના ગામ અથવા નજીકના વિસ્તારમાં આવેલી સમાન પ્રકારની જમીનની સરેરાશ વેચાણ કિંમત,
- ખાનગી કંપનીઓ માટે જમીન સંપાદનના કિસ્સામાં કલમ 2 ની પેટાકલમ (2) હેઠળ સંમત થયા મુજબ વળતરની સંમતિ પ્રાપ્ત રકમ
- RFCTLARR-2013 મુજબ R&R પેકેજ

નીચેનું કોષ્ટક અસરની શ્રેણી અને RFCTLARR મુજબ R&R ની પાત્રતા અનુસાર ઉમેદવારી મેટ્રિક્સ દર્શાવે છે. વળતર માળખાને સંચાલિત કરતા મૂળભૂત સિદ્ધાંતો નીચે દર્શાવેલ છે:

કોષ્ટક 8 વળતર માળખાને સંચાલિત કરતા મૂળભૂત સિદ્ધાંતો

S. નં	અસરની શ્રેણી	હક માટે પાત્રતા	સંબંધિત RTFCTLARR એક્ટ 2013	
1	જમીનની ખોટ	શીર્ષક ધારક	જમીનની બજાર કિંમત. આ DC દ્વારા RFCTLARR એક્ટ 2013 ની કલમો મુજબ નક્કી કરવામાં આવશે. ખોવાયેલી સંપત્તિના બદલામાં વળતરની રકમ પર વર્તમાન સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી શુલ્કની સમકક્ષ રકમ	RTFCTLARR એક્ટ 2013 મુજબ લાગુ.

		અસરગ્રસ્ત કુટુંબ/વ્યક્તિ જમીન	જમીન માટે જમીન	RTFCTLARR એક્ટ 2013 મુજબ લાગુ.
2	અન્ય સ્થાવર અસ્કયામ તોની ખોટ	શીર્ષક ધારક	જમીન અથવા મકાન સાથે જોડાયેલ અસ્કયામતોનું મૂલ્ય	અનુસૂચિ ક્રમાંક 2 (ઉક્ત અધિનિયમની કલમ 29 સંદર્ભ) હેઠળની જોગવાઈ અનુસાર આપવામાં આવશે . આ જમીન અને/અથવા માળખાના નુકસાનની સાથે પ્રદાન કરવામાં આવશે. કલેક્ટર દ્વારા આખરી ઓપ આપવામાં આવશે
3	જમીન અને અન્ય સંપત્તિની ખોટ	શીર્ષક ધારક	જમીનની બજાર કિંમત પર વધારાના 12%	જમીનની કિંમત, જમીનના સંદર્ભમાં કલમ 4 ની SIA હેઠળની (2) ની સૂચનાના પ્રકાશનની તારીખથી શરૂ થતા આવા બજાર મૂલ્ય પર વાર્ષિક વધારાના 12% ચૂકવવા પડશે, એવોર્ડ અથવા કબજો લેવાની તારીખ સુધી. જમીન જે વહેલું હોય.

8.5 જમીન/જમીનની ગુણવત્તાના આધારે વળતર માટેના માપદંડો

PAF ને વર્તમાન બજાર દર મુજબ વળતર મળવું જોઈએ અને જો તે જ સંપાદિત કરવામાં આવી રહ્યું હોય તો સંપત્તિના નુકસાનની વળતરની રકમ આપવી જોઈએ. જમીન અને મહેસૂલ વિભાગ, સરકાર. RFTLARR 2013 મુજબ દમણ યોગ્ય વળતર નક્કી કરશે.

8.6 જમીનનો ખર્ચ અંદાજ

દમણ જિલ્લા વહીવટીતંત્રે દમણમાં દરેક કેટેગરી માટે અલગ-અલગ સર્કલ રેટ્સનું વર્ગીકરણ કર્યું છે. અંતિમ વળતરનો નિર્ણય PAF સાથે સંમતિથી અને RFTLARR 2013 મુજબ થવો જોઈએ.

જમીન કિંમત અંદાજ

જે જમીન સંપાદિત કરવાની છે તે સંપૂર્ણપણે ખુલ્લી અને ખેતીની જમીન છે. તેથી જમીનની કિંમત તે મુજબ નક્કી કરવામાં આવશે.

8.7 જમીનના સંપાદન માટેની શરતો અને ભલામણો

પ્રોજેક્ટના સામાજિક ખર્ચની અસરની સરખામણીમાં એક વખત પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સમુદાયને જે લાભો પ્રાપ્ત થશે; SIA ટીમ નીચેના સબમિટ કરે છે -

- પ્રોજેક્ટ RFTLARR એક્ટ, 2013 ની કલમ 4 ની પેટા-કલમ (4) દ્વારા નિર્ધારિત માપદંડોને પરિપૂર્ણ કરે છે, જેના માટે જરૂરી છે કે પ્રોજેક્ટ જાહેર હેતુને પૂર્ણ કરે અને તેના માટે ઓછામાં ઓછી જમીન સંપાદિત કરવામાં આવી રહી છે.
- સંભવિત PAH અને પર્યાવરણ દ્વારા જે ખર્ચ કરવામાં આવશે તેને ઘટાડી શકાય છે તે સંપૂર્ણપણે બદલી ન શકાય તેવા નથી.
- તેથી, જરૂરી સંસ્થા દ્વારા વિનંતી મુજબ જમીન સંપાદિત કરી શકાય છે જેથી પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે.

જો કે, જમીનનું સંપાદન નીચે દર્શાવેલ શરતો અને ભલામણોને આધીન હોવું જોઈએ અને સામાજિક અસર વ્યવસ્થાપન યોજના અને આ અહેવાલના અન્ય સંબંધિત પ્રકરણોમાં આપવામાં આવેલ છે, જે બદલામાં, ઉપરોક્ત ખર્ચ-લાભ વિશ્લેષણ પર આધારિત છે.

8.8 જમીનના સરકાર દ્વારા મંજૂર કરાયેલા દરના આધારે જમીનમાલિકોને આપવામાં આવતી વળતરની રકમ

વળતરની રકમ યોગ્ય અને કાયદા મુજબ હોવી જોઈએ. આ ઉપરાંત, તે જમીન અને માળખાના માલિકો માટે ફાયદાકારક હોવું જોઈએ જેઓ તેમની જમીન અને બાંધકામ ગુમાવશે. જિલ્લા કલેક્ટરે સ્થાનિક જમીન મહેસૂલ વિભાગ પાસેથી આ કિંમતની માહિતી મેળવવી જોઈએ અને RFTLARR એક્ટ, 2013ની કલમ 26(1) મુજબ જમીનની હાલની કિંમત નક્કી કરતી વખતે સક્રિયપણે તેનો વિચાર કરવો જોઈએ.

સ્થાવર અસ્કયામતો માટે મૂલ્યાંકન અને વળતર

જો જમીન સંપાદિત કરવામાં આવે તો જમીન માલિકોની સ્થાવર મિલકતો જેમ કે વૃક્ષોને અસર થશે. એવી ભલામણ કરવામાં આવે છે કે આ સ્થાવર મિલકતોનું મૂલ્યાંકન અને વળતર RFCTLARR એક્ટ, 2013ની કલમ 28 અને 29 પર આધારિત હોવું જોઈએ.

અસરગ્રસ્ત વ્યક્તિઓ/પરિવારોની આજીવિકાની પુનઃસ્થાપના

અસરગ્રસ્ત પરિવારો તેમની જમીનનો એક ભાગ ગુમાવે તેવી શક્યતા છે. જો જમીન સંપાદિત કરવામાં આવે તો તેમની આજીવિકા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી સંસ્થા દ્વારા પર્યાપ્ત નાણાકીય અને ભૌતિક સહાય પૂરી પાડવામાં આવે તેવી ભલામણ કરવામાં આવે છે. ટેકો ઓછામાં ઓછો એ સ્તરે પૂરો પાડવો જોઈએ કે આવકો પૂર્વ-પ્રોજેક્ટ સ્તરો પર પુનઃસ્થાપિત થાય અને સંપાદન પછી તેમની એકંદર સુખાકારીમાં સુધારો થાય.

પ્રકરણ 9 જાહેર સુનાવણી

RFCTLARR અધિનિયમ 2013 ની કલમ 5 એ પરિકલ્પના કરે છે કે જ્યારે પણ SIA અભ્યાસ હાથ ધરવાની જરૂર હોય, ત્યારે સરકાર એ સુનિશ્ચિત કરશે કે અસરગ્રસ્ત પરિવારોના મંતવ્યો સુનિશ્ચિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં જાહેર સુનાવણી યોજવામાં આવે જે SIA રિપોર્ટમાં નોંધવામાં આવે છે અને સમાવિષ્ટ છે. . RFCTLARR એક્ટ 2013 એ જાહેર સુનાવણી હાથ ધરવા માટે વિગતવાર પ્રક્રિયાઓ નિર્ધારિત કરી છે. ઉપરોક્તને અનુસરીને, એસઆર એશિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ જાહેર સુનાવણીનું આયોજન કરશે . જાહેર સુનાવણીનું સ્થળ અને સમય આ સૂચના અને અખબારોમાં તેના પ્રકાશન દ્વારા પ્રસારિત કરવામાં આવશે.

કલેક્ટર કચેરી, દમણ દ્વારા જાહેર કરવામાં આવનાર જાહેરનામા મુજબ લોક સુનાવણી હાથ ધરવામાં આવશે. જાહેર સુનાવણીનો ઉદ્દેશ PAFs અને અન્ય હિતધારકો પાસેથી ડ્રાફ્ટ SIA રિપોર્ટ પર પ્રતિસાદ, વાંધાઓ અને સૂચનો મેળવવાનો રહેશે. તદનુસાર જોગવાઈ 8(1) મુજબ જમીન સંપાદન પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ 2013 માં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકારોનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકો દ્વારા SIA ટીમને લેખિત અને મૌખિક સ્વરૂપમાં આપવામાં આવેલા વાંધાઓ જાહેર સુનાવણી દરમિયાન રેકોર્ડ કરવામાં આવશે.

પ્રકરણ 10


ભલામણો

પ્રશ્નાવલી, PAF સાથેની મુલાકાત અને અધિકારીઓ સાથેની બેઠકો અને સાઇટની મુલાકાત દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી, પ્રોજેક્ટ ટીમે નીચેની ભલામણો વિકસાવી છે.

- સૂચિત જમીન સંપાદિત કરી શકાય છે જો કે જમીનની બજાર કિંમતને ધ્યાનમાં રાખીને વળતર આપવામાં આવશે જેથી PAP/PAF ને ઓછામાં ઓછી અસર થાય.
- RFCTLARR-2013 ના શેડ્યૂલ 2 ની તમામ જોગવાઈઓ ધ્યાનમાં લેવી જોઈએ.
- વિશ્લેષણ મુજબ, સૂચિત જમીન પ્રોજેક્ટ માટે યોગ્ય હોવાનું જણાયું હતું. જિલ્લા વહીવટીતંત્ર પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારો સાથે નિયમો અને શરતોની ચર્ચા કરવા માટે જોડાઈ શકે છે અને સૂચિત પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવી શકે છે.
- જો તેમને નાની દમણ કિલ્લાની આસપાસ દુકાનો અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ સ્થાપવાની પરવાનગી આપવામાં આવે તો કેટલાક PAP સૂચિત પ્રોજેક્ટ માટે તેમની જમીન આપવા તૈયાર છે. તેથી, PAPs ને નાની દમણ કિલ્લાની આસપાસ સૂચિત વિકાસ કાર્ય અને વ્યુટિફિકેશનનો લાભ લેવા માટે નજીકના વિસ્તારમાં દુકાનો સ્થાપવાની પરવાનગી આપવામાં આવી શકે છે.
- બાંધકામ અથવા વિકાસના તબક્કા દરમિયાન અસર ઘટાડવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી શકે છે.

ફોટો ગેલેરી





નાની દમણ કિલ્લાની આસપાસ કામના વિકાસ અને બ્યુટીફિકેશન માટે જમીન સંપાદન અંગેનો ડ્રાફ્ટ SIA રિપોર્ટ.



નાની દમણ કિલ્લાની આસપાસ કામના વિકાસ અને બ્યુટીફિકેશન માટે જમીન સંપાદન અંગેનો ડ્રાફ્ટ SIA રિપોર્ટ.



સંદર્ભ

1. જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ 2013 માં વાજબી અને પારદર્શક વળતરનો અધિકાર
2. જિલ્લો દમણ વસ્તી ગણતરી હેન્ડબુક (2011) (https://censusindia.gov.in/2011census/dchb/2502_PART_B_DCHB_DAMAN.pdf)
3. દમણ વિકિપીડિયા પ્રોફાઇલ (https://en.wikipedia.org/wiki/Daman,_India)
4. દમણ અને દીવ, બજાર સંશોધન વિભાગ, પ્રવાસન વિભાગ, પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર માટે 20-વર્ષીય પરિપ્રેક્ષ્ય યોજના પર અંતિમ અહેવાલ
<https://tourism.gov.in/sites/default/files/2020-04/daman%26diu2.pdf>

જોડાણ

પરિશિષ્ટ 1: સર્વે પ્રશ્નાવલી

સામાજિક/આર્થિક સર્વેક્ષણ પ્રશ્નાવલી

પ્રશ્નાવલી સંઠ

1. સામાન્ય પહચાન (General Identification)

ઉચ્ચ પરિયોજના કા નામ :			
સર્વેક્ષણ/સત્યાપન દિનાંક		સ્થિતિ (વાહિને/બાણ હાથ કી ઓર)	
ગાંવ/કસ્બા		ગ્રામ પંચાયત/નગરપાલિકા	
તહસીલ		જિલા	
પહચાન સંઠ		ચૈનેજ સંઠ	

2. પ્રભાવિત પરિવાર કી પહચાન (Identification of AF)

મૂ-સ્વામી/સંરચના માલિક કા નામ	
પિતા/પતિ કા નામ	
સંપર્ક નંઠ	

3. મૂ-સ્વામી/સંરચના માલિક કે બેંક ખાતે કા વિવરણ (Bank details of Land Owner/Structure Owner)

બેંક ખાતા નંઠ	
બેંક/શાખા કા નામ IFSC કોડ સહિત	

4. મૂમિ કા સ્વામિત્વ (Ownership of the Land)

(1) નિજી (2) સરકારી (3) ધાર્મિક (4) અન્ય

5. મૂમિ કા પ્રયોગ (Use of Land)

(1) સ્વેતી (2) બગીચા (3) આવાસીય (4) વ્યવસાયિક (5) અન્ય

6. कृषि भूमि का वर्गीकरण (Classification of Agricultural Land)

(1) सिंचित (2) असिंचित (3) बंजर (4) अन्य

7. प्रभावित परिवार की श्रेणी (Category of AF)

(1) मू-स्वामी (2) अतिक्रमणकारी (3) उपवेशी (4) किरायेदार

(5) दिहाड़ी मजदूर (6) क्योरक (7) बटाईदार (8) अन्य

8. परिवार प्रश्नावली (Household Schedule)

(क) उत्तरदाता का नाम

(ख) उत्तरदाता का मू-स्वामी/संरचना मालिक के साथ सम्बन्ध

(ग) परिवार का प्रकार:-

(1) एकल

(2) संयुक्त

(3) अन्य

(घ) धार्मिक समूह:-

(1) हिन्दू

(2) मुस्लिम

(3) सिक्ख

(4) इसाई

(5) जैन

(6) बौद्ध

(7) अन्य

(ङ) सामाजिक स्तर:-

(1) अनु०

(2) अनु० जनजाति

(3) अन्य पिछड़ी जाति

(4) सामान्य जाति

जाति

(च) परिवार का विवरण (Household Particulars of Family)

क्र० सं०	परिवार के सदस्यों के नाम (पहला नाम मू-स्वामी/संरचना मालिक)	मू-स्वामी /संरचना मालिक से सम्बन्ध	लिंग (पु०/ म०)	उम्र	शिक्षा	वैवाहिक स्थिति	मुख्य आय प्रतिविधि	आय प्रतिमाह	विकलांगता (शारीरिक या मानसिक)
1	2	3	4	5	6	7	8	9	10
1.									
2.									
3.									
4.									
5.									
6.									

7.									
8.									
9.									
10.									
11.									

9. केवल भू-स्वामियों के लिए (Only for the Title Holders)

प्रभावित भूमि का विवरण (Details of affected Land)

- (1) खाता सं० :
- (2) खसरा सं० :
- (3) प्रभावित भूखण्ड का कुल क्षेत्रफल (हे० में) :
- (4) प्रभावित भूखण्ड का प्रभावित क्षेत्रफल (हे० में) :

10. संरचना का विवरण (Details of affected Structure)

(क) सड़क के प्रस्तावित मध्य से संरचना की दूरी (मी० में)

(ख) प्रभावित संरचना का प्रयोग (Use of affected Structure)

(1) आवासीय (2) व्यवसायिक (3) आवासीय एवं व्यवसायिक (4) अन्य (लिखिये)

(ग) संरचना/ढांचे का मालिकाना हक

(1) निजी (2) सरकारी (3) धार्मिक (4) सामुदायिक (5) अन्य

11. (क) यदि आप विस्थापित होते हैं तो आप कहाँ बसना चाहेंगे ? (स्थल का विवरण दें)

(ख) संरचना की अनुमानित लागत (रु० में)

12. संरचना की माप (मी० में)

संरचना की माप	लम्बाई	चौड़ाई	ऊँचाई
संपूर्ण क्षेत्रफल			
प्रभावित क्षेत्रफल			

13. संरचना का प्रकार

(1) पक्का (2) कच्चा (3) अर्धपक्का (4) अन्य

14. संरचना में प्रयुक्त निर्माण सामग्री का विवरण

छत

आर०सी०सी०	आर०बी०सी०	खपरैल	लकड़ी, ईट और मिट्टी	पत्थर	अन्य उल्लेख कीजिए

दीवार

ईट सीमेन्ट	ईट, सुखी और चूना	ईट मिट्टी	मिट्टी	पत्थर	अन्य उल्लेख कीजिए

फर्श

पत्थर की मिट्टी का पक्का फर्श	ईट की मिट्टी का पक्का फर्श	सोलिंग/खड़जा	पत्थर की पटिया का फर्श	कच्चा फर्श	अन्य उल्लेख कीजिए

15. आवासीय संरचना (Residential Structure)

- (1) संरचना कितनी पुरानी है ? (वर्षों में)
- (2) क्या कोई किसानेदार है ? (1. हाँ/2. नहीं)
- (यदि हाँ तो इसका विवरण तालिका संख्या 16 में अंकित करें)
- (3) क्या गृह कर दे रहे हैं ? (1. हाँ/2. नहीं)
- (4) क्या बिजली है ? (1. हाँ/2. नहीं)
- (5) क्या पानी का कनेक्शन है ? (1. हाँ/2. नहीं)
- (6) यदि पानी का कनेक्शन नहीं है, तो पीने के पानी का क्या स्रोत है ?
- (7) क्या शौचालय की सुविधा है ? (1. हाँ/2. नहीं)
- (8) खाना पकाने के लिए ईंधन की क्या सुविधा है ?

19. केवल बटाईदारों के लिए (Only for Share Cropper)

क्र० सं०	नाम	कार्य करने की अवधि	बटाई की भूमि हे० में	औसत उपज का मूल्यांकन (रु० में)	औसत उपज में भागीदारी % में
1.					
2.					
3.					

20. प्रभावित परिवार अन्तर्गत वस्तुधन स्वामित्व विवरण (Detail of Live Stock Owned by AF)

क्र०सं०	पशुओं का नाम	कुल संख्या	क्र०सं०	पशुओं का नाम	कुल संख्या
1.	गाय		6.	घोड़ा	
2.	भैंस		7.	हार्थी	
3.	ऊँट		8.	भेड़	
4.	गधा		9.	बैल	
5.	बकरी		10.	अन्य	

21. प्रभावित परिवार के स्वामित्व अन्तर्गत अन्य संपत्तियों का विवरण (Detail of Other Assets Owned by AF)

क्र०सं०	संपत्तियों का नाम	कुल संख्या	क्र०सं०	संपत्तियों का नाम	कुल संख्या
1.	साइकिल		6.	वॉशिंग मशीन	
2.	दो पहिया वाहन		7.	कंप्यूटर	
3.	चार पहिया वाहन		8.	मोबाइल/लैंडलाइन फोन	
4.	गैस कनेक्शन		9.	ट्रैक्टर	
5.	टेलीविजन		10.	अन्य	

22. क्षमता वर्धन हेतु प्रशिक्षण के लिए विकल्प (Alternative for Training's)

1. प्रशिक्षण ट्रेड के लिए विकल्प
2. प्रशिक्षण लेने वाले रादरय का नाम व उम्र
3. क्या प्रशिक्षण के उपरान्त सम्बन्धित रोजगार अपनाना चाहेंगे ? (हाँ / नहीं)
4. क्या स्वरोजगार आपकी प्राथमिकता होगी ? (हाँ / नहीं)

23. प्रमाण-पत्रों का सत्यापन :-

- | | | | | | |
|----------------------|---|---|------------------------|---|---|
| (1) आधार कार्ड | [|] | (2) राशन कार्ड | [|] |
| (3) चुनाव पहचान-पत्र | [|] | (4) पंजीकृत किरायानामा | [|] |

- (5) बैंक पासबुक [] (6) पंचायत प्रमाण-पत्र []
 (7) इकरारनामा/नोटरी [] (8) अन्य (लिखिए) []

24. विपन्न परिवार का सत्यापन :-

- (1) बीपीएल [] (2) वृद्ध []
 (3) अनुसूचित जाति [] (4) अनुसूचित जनजाति []
 (5) विकलांग [] (6) महिला मुखिया परिवार []

25. Identified or Verified from PAP:-

लिंगानुपात संवर्धन (Gender Promotion)

1.	क्या आप के घर में पत्नी का बैंक खाता है ? यदि हाँ तो एकल है या संयुक्त	एकल	संयुक्त
2.	क्या आपके घर में महिलाओं की समान रूप से क्रय विक्रय, अथवा समस्याओं के निराकरण इत्यादि में निर्णायक भूमिका की सहमति ली जाती है ?	हाँ	नहीं
3.	क्या आपके घर में महिला सदस्यों की उच्च शिक्षा हेतु सहमति है?	हाँ	नहीं
4.	घर की कोई महिला सदस्य स्वयंसहायता समूह इत्यादि की सदस्य है?	हाँ	नहीं
5.	घर की कोई महिला सदस्य, ग्राम पंचायत की सदस्य है?	हाँ	नहीं
6.	घर की कोई महिला सदस्य किसी भी प्रकार के व्यवसाय/नौकरी में सम्मिलित है?	हाँ	नहीं
7.	घर की महिला सदस्यों के नाम से किसी भी प्रकार की प्रापर्टी/सम्पति/चल-अचल सम्पति क्रय की गयी है?	हाँ	नहीं
8.	क्या आप अपने परिवार में महिलाओं को क्षमता संवर्धन हेतु ट्रेनिंग/प्रशिक्षण दिलवाना चाहते हैं?	हाँ	नहीं

उत्तरदाता का नाम : हस्ताक्षर दिनांक

पर्यवेक्षक का नाम : हस्ताक्षर दिनांक

पी०डब्लू०डी० प्रतिनिधि का नाम : हस्ताक्षर दिनांक